



# વિહંગ

પક્ષીનિરીક્ષકો પરચોનો જેતુ

શાર્દુ ૨૦૦૨



પરામર્શક : લાલભિંહ રાઓલ

સંપાદક : ડૉ. બનુલ તિવેદી

# પંખીપુસ્તક પરિચય શ્રેણી - C

લાલસિંહ રામોલ



## 'પંખીમેળો'

વેદક : દિનકરાય વૈદ્ય 'મીનપિયાસી'

શ્રી દિનકરાય વૈદ્ય ઉદ્ડે 'મીનપિયાસી' આપણા એક જુન પક્ષીનિરીક્ષક. તેમો કવિ અને ખગોળવિદ્ધ પણ હતા. તેમના બે કાવ્યસંગ્રહો અને એક ખગોળપુસ્તક પ્રસિદ્ધ થયા છે. પંખીઓના જીવન વિશેની અને નાઃસરોવરના પંખીઓ વિશેની એમ તેમની બે પુસ્તિકાઓ અગાઉ પ્રસિદ્ધ થયેલી. વરસો પહેલાં મુંબઈના એક વર્તમાનપત્રમાં પંખીઓ વિશે તેમની એક લેખમાણ છાપાયેલી.

નજુક તથિયતને કરાણો તેઓ બહુ મુસાફરી ન કરતા, પણ પાંચ-છ દાયકા સુધી પોતાના વતન ચુડાની પક્ષીસૂચિનું ઊડાણથી નિરીક્ષણ કરતા રહેલા. થોડાં વરસ પહેલાં નેચું વરસની ઉમરે તેમનું અવસાન થયું. સફભાયે પંખીઓના તેમના ઘનિષ્ઠ નિરીક્ષણોનો લાભ તેમના પુસ્તક 'પંખીમેળો'માં આપણાને મળ્યો છે. આ માટે માહિતીભાતાને ધન્યવાદ. પુસ્તકમાં ૧૬૫ જેટલાં પંખીઓનો પરિચય આપ્યો છે.

પંખીઓની ઓળખાણ કરાવતાં પુસ્તકો સાદા શિત્રોવાળાં નહીં પણ રંગીન શિત્રોવાળાં હોવા જોઈએ. શ્રી મિનપિયાસીના 'પંખીમેળો' નામના આ પુસ્તકમાં સમાવિષ્ટ દરેક પંખીનું રંગીન ચિત્ર છે. તે ઉપરાંત બિનજરૂરી ફોટોઓની તેમાં ભરમાર છે. ગુજરાત સરકારના માહિતીભાતા જેવા માતબર પ્રકાશકનું આ પુસ્તક, છપાઈ અને સંજાપટની દસ્તિએ એકદમ નિરાશાજનક છે. ફોટોઓની પસંદગીમાં કોઈ માપદંડ જગાવાયો નથી. એકના એક પંખીના અનેક ફોટો આપ્યા છે. જ્યાં આપ્યા, પણ તેમાં કલાત્મકતા કે વિશિષ્ટતા હોવી જોઈએ કે નહીં? આમાં તો જે હાથે ચઢ્યા તે સથળા આડેધ છાપી નાખ્યા છે. તેના ઔચિત્યનો વિચાર જ કર્યો નથી. વળી આ રંગીન ફોટોઓની છપાઈ અસંતોષકારક છે. ગુલાબીપેણ (Rosy Pelican) ના વિના કારણ દેસેક ફોટો જ્યાં તાં છાપ્યા છે. તે જ પ્રમાણે પત્રંગિયા, વાણિયા (Dragon Fly), કમળ, આકરો, સૂર્યોદય વગેરેના ફોટોઓની કોઈ ઉપયોગિતા કે જરૂરિયાત અહીં દેખાતી નથી. આવા તો અનેક ડિસ્સા છે.

પંખીઓનું પુસ્તક વિજ્ઞાન વિષયક ગણાય. તેનું 'મુફરીડીગ' લેખકે કે જ્યાંકાર વ્યક્તિએ કરવું જોઈએ. આ પુસ્તકમાં તેમ નથી થયું. વિરામ ચિક્કો અનેક વાર ખોટી જગાએ છાપ્યાં છે. આથી વર્ણનમાં અસ્પષ્ટતા પેદા થાય છે. ચકવા (Indian Stone Cur-

lew) અને મોટા ચકવા (Great Stone Plover)ના વર્ણનની એકબીજામાં લેખસેળ થઈ ગઈ છે.

તે જ પ્રમાણે તારપુછ તારોડિયા (Wiretailed Swallow)ના વર્ણનનાં બે વાક્યો અભાવી (Dusky Crag Martin)માં ધૂથી ગયા છે. આપણે તાં શિયાળામાં આવતી ટપકીલી તુતવારીનું સાચું અંગેજ નામ Wood Sandpiper છે, પણ શરતચૂકી અહીં Spotted Sandpiper છાયું છે. પૃ. ૬૨ ઉપર ગારખોદ (Fantail Snipe)ના પરિચયમાં આપેલ ચિત્ર કાળીપુંછ ગડેરા (Blacktailed Godwit)નું છે. શ્યામકંઠ રણપિહા (Desert Chat) ના બે ચિત્રો પૃ. ૧૩૭ અને ૧૩૮ ઉપર છાપ્યા છે પણ તેનો પરિચય લેખ જ છાપવો રહી ગયો છે! આ તો થોડા નમૂના આપ્યા છે. લેખકને 'મૂફુ' જોવાની તક મળી હોત તો આ અને આવી આવી ક્ષતિઓ તેઓ જરૂર દૂર કરતા.

લેખકનાં અમુક વર્ણનો તાદેશ છે. દા.ત. પાણી પર ઉત્તરતી ગુલાબી પેણનું વર્ણન જુઓ. "છોકરા ત્રાંસા પાટિયા પર લસરતા હીય તેમ તે ત્રાંસી સરકતી આવે અને આસાનીથી સાચ હળવેકથી પાણી પર બેસી જ્યા." બીજો નમૂનો જોઈએ. "સિરકીર એટલે ઉડતો નોળિયો જ. એને તેમે ઉડતું જોયા પછી જમીન પર દોડતું જુઓ તો એમ જ થાય કે આ નોળિયો જ છે. ઉડતું જોયું તે ભમ હશે."

યોગ્ય જગ્યાએ યોગ્ય ચિત્રો મૂક્યા હોત તો સજાવટ સારી બનત. ઉપર નિર્દિષ્ટ સર્વ ક્ષતિઓ લેખકની નહીં પણ સજાવટ કરનારની છે.

સરકારી પ્રકાશનોમાં હંમેશા થાય છે તેમ પુસ્તક રસ ધરાવનાર વ્યક્તિને નહીં પણ જેને બિલકુલ રસ ન હીય તેને મળે છે. માહિતીભાતાના પ્રકાશન વિભાગમાં આ પુસ્તક ખરીદવા જાવ તો કિંમત રૂ. ૨૦૦/- થાય, પણ ગુજરી બજારમાંથી માત્ર રૂ. ૨/- માં એક મિત્ર એ તે ખરીદેલ. મેં તે મિત્રને મીઠો ઠપકો આપ્યો અને કહું. "અરે ભલા માણસ, એ રૂપિયામાં આ પુસ્તક મળતું હતું. તો વેચનાર પાસે જે આદદ્સ નકલો હતી તે બધી ખરીદી લેવી હતીને! કોઈ રસ ધરાવનારને બેટ આપવા કામ લાગત !

સી-૨, હરિઓમ એપાર્ટ, 'ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' પ્રેસ રોડ,  
જવરાજ પાર્ક, અમદાવાદ-૫૧

## સૂવિ

પુરતકપદ્ધિબય શ્રેણી - C  
‘એફીમેળો’



### લિંગાવલોડન

આપણાથી જ શરૂઆત !

૪

### નિર્જ્ઞાણ નોંધ

- ભૂલાભૂલ ઠોળીલિનો માળો
- શ્રીતપુષ્ટ ટિટોડીનો માળો
- Birdlife around Hingol gadh

૫

૧૩

૧૫

### શાકશ વોચ

૧૬

### ગીધ પર જાપતો

૧૭

### પત્રસેતુ

કચ્છમાં મસ્કતી લટોરાની હાજરી

૨૨

૨૪

### મ.લુ.હિમતાંસિહલણી ડલમે

કચ્છ ઘણું જાળવાનું બાકી છે !

૨૮

### આવરણ

લફ્ફડખોદ (Yellowfronted Pied Woodpecker)

તસવીર: મુકેશ ભટ્ટ, સુરત

૨૯



## વિહંગ

વર્ષ-૫ સંખ્યા અંક ૧૭ શારદ ૨૦૦૨

પરામર્શક સંપાદક  
લાલસિંહ રાઓલ ડૉ. બનુલ ત્રિવેદી  
સંપાદક મંડળ  
પી.એસ.ટક્કર, ડૉ. આર. બી. બલર, કે.ડી. વૈધ્યવ  
પત્રબ્ધવહાર  
૧૭/૪૧૪, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ,  
અમદાવાદ-૩૮૦૦૫૫

E mail : vihangujarat@yahoo.co.in  
સૈચિંહ લવાજમ : વાર્ષિક રૂ. ૧૦૦-૦૦  
(શુભેણા ફાળો આપકાર્ય -  
'વિહંગ' ના નામે ચેક/પ્રાઇવેટ અથવા મ.ઓ.થી.)  
પ્રકાશક : લાલસિંહ રાઓલ, સી-૨, હરિઝોમ  
એપાર્ટમેન્ટ, ટાઈમ્સ ઓફ ઇન્ડીયા પ્રેસ પાસે,  
અવરાજ પાર્ક, અમદાવાદ-૩૮૦૦૫૧.  
મુદ્રક : ડૉ. બનુલ ત્રિવેદી, મુદ્રણસ્થાન : 'શારદ  
પ્રકાશન', પ, સનપોર્ટન કોમ્પ્લેક્સ, ગુરુકુળ ટાવર સામે,  
અમદાવાદ-૩૮૦૦૫૨.

## સંપાદકીય



‘વિહંગ’ આ અંકથી સૈચિંહ લવાજમ શરૂ કરે છે. ઘણાં મિત્રો અને પ્રશંસકો ગ્રશ કરતાં રહે છે. “લવાજમ કેટલું છે?” કેટલાંક હિતેઘુંઘો લવાજમ દાખલ કરવાની સલાહ પણ આપતાં રહે છે. અમે વચ્ચેનો માર્ગ સ્વીકાર્યો છે. ‘વિહંગ’ને પોતાનો વ્યાપ વિશાળ જ રાખવો છે અને અમુક રસ ધરાવતી, સૌંદર્યો આડકતરી રીતે આ સેન્ટ ટ્રાવે સંકલાયણલો વ્યક્તિઓ સુધી પહોંચવાનો તેનો આગ્રહ પણ કાયમ છે. આ દાખિએ ‘સૈચિંહ લવાજમ’નો માર્ગ યોગ્ય લાગ્યો છે. વાંચકોને પણ વિકલ્પોનો અવકાશ રહેશે. આપ સૌના સહકારથી જ ‘વિહંગ’ની ઉડાન અવિરત ચાલુ રહી છે.

આ વર્ષ પણ વરસાદની ખોટ વરતાઈ. કેટલાક વિસ્તારોમાં અત્યારથી જ જળાશયો ખાલી થવા માંડયાં છે. નન્સરોવરમાં પાડી ઘણું ઊંઘું થઈ ગયું છે. અમુક જળાશયો, જ્યાં નર્મદાનાં પાડી કેનાલ મારફતે પહોંચ્યાં છે, ત્યાં પાડી ભરેલાં છે. થોળનું તથાવ તથા તેની આસપાસનાં ગામ-તણાવો, નારદા, પરિઅંજ તથા ખેડા જિલ્લાનાં અન્ય કેટલાંક જળાશયો નર્મદાના પાડીથી છલોછલ છે. આ બદલાયેલી પરિસ્થિતિમાં સ્થાનિક તથા યાયાવર પક્ષીઓના વ્યાપમાં ફેરફારો ચોક્કસ નોંધાશે. નર્મદાનાં નીર હવે જ્યારે ગુજરાતી ધરતી પર દૂર દૂર સુધી પ્રસર્યો છે, ત્યારે લાંબા ગાળે તેની સમગ્રતઃ પર્યવરણ તથા જૈવિકાંત્ર ઉપર કઈ અસરો થશે, એ અભ્યાસનો વિષય બની રહેશે. જુદી - જુદી પક્ષીજાતિઓની હાજરી, ફેલાવો, સંખ્યા અને વર્તનમાં આ સંદર્ભે જે દીર્ઘકાળિન પરિવર્તનો થશે તે જેવું, જાણવું રસમદ બની રહેશે તથા આપણે સૌંદર્યો એ ફેરફારોની જગ્યાત્પણે નોંધ રાખવી પડશે.

કચ્છના નાના રણમાં નાના હંજના પ્રજનનના સમાચાર છાપામાં વાંચાયાં. કેટલાક સમાચારના પ્રસારની બહુ આવશ્યકતા નથી હોતી. ક્યારેક તેનું પરિણામ વિપરિત પણ આવી શકે. માત્ર અધિકૃત વ્યક્તિઓ જ આવી ઘટનાની નોંધ રાખે તથા તેમાં આવતા વિશેપોનો દૂર કરી તેનું નિયમિત પુનરાવર્તન થાય તેવાં પગલાં લે, તે ઈચ્છનીય છે. મ્રચાર-પ્રસાર માધ્યમોએ આ અંગે સ્વશિસ્ત દાખલવી માત્ર આવકાર્ય જ નહીં અનિવાર્ય છે. પક્ષીસંરક્ષણ જ આપણા સૌંદર્ય લક્ષ્ય હોય અને પક્ષીનિરીક્ષણ કે ફોટોગ્રાફી જેવા શોખ તેમાં પૂરક બની રહે, તે માટે આપણે સચેત છીએ ?

\*

## નિહંગાવલોકન

આપણાથી જ શરૂઆત !

ચોમાસુ લગભગ પૂરું થવા આવ્યું. યાયાવર પક્ષીઓ આવવાનાં શરૂ થઈ ગયાં છે. ૧૮મી સાઠે.., ગુરુવારના રોજ જામનગર પાસે સૂર્યાસ્તવેળાએ કરકરાના ટોળાને જમીન પર ઉત્તરાંશ કરતાં સાંભળ્યાં. એ પહેલાં ડિગોળગઠમાં મોટી બપોરે અચ્ચા ચાંદે, મોટી સંખ્યામાં શિથાળું તારોડિયા ને આવતાં તથા પશ્ચિમભાષી પ્રયાણ કરી જત્તા કે .. . . અંગાવમાં સ્પેટ્ટેડ માઝીમાર (Spotted Flycatcher) તથા વીજળાના તાર ઉપર કાશીરી ચાખ (Kashmir Roller) ને બેઠેલાં જોયા. આ બધાં વટેમાર્ગું યાયાવર (passage migrants) પક્ષીઓ શિથાળો પૂર્વ આંકિકામાં ગાળશે.

પક્ષીઓનાં આ ટોળાંઓને પસાર થતા જોઉ છું ત્યારે મારી સ્મૃતિમાંથી એ દષ્ય તારું થાયે છે જ્યારે ભૂતકાળમાં આવાં ખૂબ મોટાં ટોળાં પસાર થતાં હું જોતો. બસ આછું આછું યાદ આવે છે. માત્ર વીસેક વર્ષો પહેલાં પક્ષીઓની અમુક જાતિઓ જે વિપુલ સંખ્યામાં જોવા મળતી હતી તે હવે નાનાં સમુદ્રોમાં જ દેખાય છે. પક્ષીઓની સંખ્યામાં સમગ્રત: જે ધરમખ ઘટાડો જાણાય છે, તે જોઈને છીવ બળે છે. કારણો સ્પષ્ટ છે અને જો આપણે જાગૃત નહીં થઈએ અને સામૂહિક રીતે એક બુલંદ અવાજ નહીં ઉડાવીએ તો તેનાં ઉપાયો સરળ લાગવા છતાં અશક્ય બની રહેશે.

આપણે ચોક્કસ નીતિ ઘડવી પડશે. સદ્ગનસીબે પક્ષીની બધી જ જાતિઓ માટે એવા અથાગ પ્રયત્નોની જરૂર નથી. બસ વ્યક્તિગત રીતે જ થોડા ફેરફારોની આવશ્યકતા છે. 'ફિક્સ' વૃક્ષો વાવીને તેનાં નાનાં ઝૂંડ ઊભાં કરીએ અથવા હાર ઉભી કરીએ તો કોણ ના પાડે છે? દાખલા તરીકે

લવકુમાર ખાયર

(અનુ: ડૉ. બકુલ ત્રિવેદી)



વડોદરામાં રસ્તાની બાજુમાં  
વડલાની કેટલી સુંદર હાર છે!  
થોડાં વર્ષોમાં

અમદાવાદમાં મેં મારી રીતે થોડાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો છે. કેટલીક રહેણાંક યોજનાઓમાં જુદાં જુદાં પક્ષી-વૃક્ષોનો સમાવેશ થયો છે. અમુક ખાનગી બગીચાઓમાં પણ પક્ષીઓ માટે સ્વર્ગ ઊભાં થયાં છે કર્ણાવતી કલબ પાછળ આવેલા 'દ્વામના કષ્માસ-બક-ન્યા પાણો ચૂંચે છે.

મારે શાહીબાગ (અમદાવાદ)માં શ્રીમતી શમાબેન (સારાભાઈ)ના રહેણાં ઉપર જવાનો પ્રસંગ બન્યો હતો. ખૂબ જ સુંદર અનુભવ હતો. જે પ્રયત્નો થયાં હશે તે ખરેખર ફળીભૂત થયા, એમ તેમનાં મકાનની આસપાસનું વાતાવરણ જોઈને લાગે. સાબરમતી તથા મહીના કિનારે આવી બીજી પણ યોજનાઓ વિકસે તો પક્ષીજગતની સમૃદ્ધિ જરૂર વધે.

હવે જ્યારે ગાંધીનગરથી રાજકોટ મારું નિવાસ મેં બદલ્યું ત્યારે, રાજકોટના મારા બગીચાને વૃક્ષો અને વેલા ઉંઠેરીને ફરી જીવંત કરવો છે. આશા રાખું કે, થોડાં વર્ષોમાં મારા ધરની આસપાસ નાનું જંગલ ઊભાં થઈ જાય. મારા ધરની બહાર ચારસ્તાની વચ્ચે સ્વ. શ્રી સલીમઅલીએ વાવેલો વડ સદ્ભાર્યે સુંદર વૃદ્ધિ પામ્યો છે. મારા પડોશીઓ પણ તેમના નિવાસસ્થાનોની આસપાસ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપે છે. ભૂતકાળનાં ખેતરોનું સ્થાન હવે શહેરી બાંધકામોને લીધું છે, ત્યારે રસ્તાની આજુબાજુનાં વૃક્ષો છાંધો આપવાનું ચાલુ રાખે અને તેમાં પુષ્ણ પક્ષીઓ વસવાટ કરશે એવી આશા રાખીએ.

૧૪, જ્યંત સોસાયટી, રાજકોટ-૩૬૦૦૦૪



## નિરીક્ષણ નોંધ

લાખોટા તળાવમાં પક્ષીનિરીક્ષણ

તા. ૨૬-૩-૦૨ના રોજ જામનગરના લાખોટા તળાવમાં  
પક્ષીનિરીક્ષણ કર્યું. લગભગ ૨૫ વર્ષ પછી અહીં આવ્યો. શ્રી

લાલસિદ્ધભાઈના માર્ગદર્શન ડેણ  
પક્ષીનિરીક્ષણ ચાલુ કર્યું હતું.

તળાવ ઊંડું કર્યા પછી મુખ્ય તળાવમાં પક્ષીઓની સંખ્યા



વધી છે. મેં આ મુજબ પક્ષીઓની નોંધ કરી.

ટીલિયાળી બટક (Spotbilled Duck) - ૧૮૦, ગયણો (Shoveller) - ૧૬૦, પિપાસડા (Wigeon) - ૨, કાબરી કારચિયા (Tufted Pochard) - ૪, ભગડાડા (Coot) - ૩૦, નાની ડુલકી (Dabchick) - ૧૨, શ્યામશિર ધોમડા (Blackheaded Gull) - ૫૦૦, કાળીપુંછ ગડેરા (Blacktailed Godwit) - ૧૦૦ વગેરે. આ ઉપરાંત, ભગવી સમડી (Brahminy kite) - ૨, નીલ જલમુરઘો (Purple Moorhen), કાર્મિયા (Cormorants), બગલા (Egrets), પીળીચાંચ ઢોંક (Painted Stork) વગેરે પક્ષીઓ જોયા.

અહીં પક્ષીઓ માઝસોથી ગભરાતાં હોય તેવું લાગતું નથી. ધોમડા (Gull) ને તો લોકો નિયમિત ચણ પક્ષ નાંખે છે.

ડૉ. પી. પી. મુખદિયા

મુખદિયા સર્વકલ ધોસ્થિયા, ગાપત્રી મંદિર રોડ, જાસ્તરાબાદ રોડ, રાજુલા-૩૬૫૫૦

અભિનિત



### સાવરકુંડલા તાલુકામાં મત્સ્યગરૂડ

તા. ૩૦-૮-૨૦૦૨ના રોજ સાવરકુંડલા તાલુકાના ધાંધાલા ગામે ધાતરવડી નદી ઉપરના વિશાળ જળરાશિ ધરાવતા બંધ (કયો ?-સં.) ઉપર એક મત્સ્યગરૂડ (Pallas's Fishing Eagle) ને માછળી પકડતો જોયો. હજુ ચોમાસુ ચાહું છે, શિયાળો બેઠો નથી, છતાં મત્સ્યગરૂડ જોવા મળ્યો, આમ કેમ?

→ સાવરકુંડલા પાસે કાબરો રાજલાલ

(Whitebellied minivet)

તા. ૧-૪-૦૨ ના રોજ સાવરકુંડલાથી ઉ.ક્ર.મી. દૂર, જ્યાં વન વિભાગ તરફથી સરકારી પડતર જમીનમાં દેશીતથા ઈજારેલી બાવળનું વાવેતર થયેલું છે, ત્યાં પક્ષીદર્શન માટે ગયા હતા. ત્યાં એક સાથે ૧૪ (૬ નર, ૮ માદા) કાબરો રાજલાલ જોયા. તેઓ બાવળની પાતળી ડાળી પર એકો સાથે બેઠો હતો. અમને થયું કે, આ રેમની રાતવાસાની જગ્યા હશે. બીજે દિવસે સવારમાં તપાસ કરતાં ધૂટા-ધ્વાયા પાંચ-છ પક્ષીઓ મળ્યાં. આ પક્ષી, આ વિસ્તારમાં અગાઉ ક્યારેય

નહીં જોયેલું હોવાથી નવાઈ ઉપજી.

અનિરુધ્ધ અધ્વર્યુ

૩૭, વિદ્યુતનગર, સાવરકુંડલા



### કચુમાં પક્ષીનિરીક્ષણ

→ તા. ૨-૧૨-૦૧ના રોજ છારી હંદની મુલાકાત લીધી. મારી સાથે નવીન બાપટ તથા અશ્વિન પોમલ હતા. આ મુજબ અમે પક્ષીઓ જોયાં : મોટાં હંજ (Greater Flamingo) - ૧૦૦૦, નાનાં હંજ (Lesser Flamingo) - ૪૦૦૦, કુંજ (Common Crane)- ૭૦, રષાપિણી (Desert Chat) - ૧, દેશી ગુમ્બસ (Tawny Eagle) - ૪.

→ છારી હંદના રસ્તે જતાં વચ્ચે, એક મોટો ધુવડ (Great Horned Owl) પણ જોયો હતો. અહીં વગડાડ બટાવડા (Indian Sandgrouse) નાં ટોળા ઉપર ત્રાટકતી એક ઉજળી પકાઈ (Pale Harrier) જોઈ.

→ તા. ૧૦-૧૨-૦૧ના રોજ અમે ફરી છારી હંદ ગયા. તે દિવસે નીચેનાં પક્ષીઓ જોયા.

મોટાં હંજ (Greater Flamingo) - ૧૦૦૦+, નાનાં હંજ (Lesser Flamingo) ૬૦૦૦+, ગુલાબી પેણ (Rosy Pelican) - ૮૦૦ +, રાખોડી કારચિયા (Common Pochard) - ૮૦૦+ (ભૂખીએમ), પરદેશી ગુમ્બસ (Steppe Eagle) - ૩ (છારી હંદના નજીક), દેશી ગુમ્બસ (Tawny Eagle) - ૫ (છારી હંદ અને તેની આસપાસ).

→ તા. ૧૩-૧૨-૦૧ના રોજ કવિ તેજ તથા આર.ડી. જેઝ સાથે નાલિયા નજીકના ધાસિયા પ્રદેશની મુલાકાત લીધી. અહીં જોયેલાં પક્ષીઓ આ મુજબ હતાં.

ધોરડ (Great Indian Bustard, માદા) - ૧, નાની બીલબટેર (Little Bustard Quail) - ૧, ઉજળી પકાઈ (Pale Harrier) - ૩, પદી પકાઈ (Montagu's Harrier) - ૨, રષાપિણી (Desert Chat) - ૮, મેંદિયો પિણો (Collared Bush Chat) - ૫, સંકુંગૂલ (Short-toed Lark) - ૨૫, શિયાળુ ટીસો (Long Legged Buzzard) - ૧, લરજ (Kestrel) - ૧, વગડાડ

ધાનચીડી (Tawny Pipit) - ૫, મોટી ધાનચીડી (Brown Rock Pipit) - ૬, કાળો તેતર (Black Partridge) - ૧, નાની પાન ટીકટીકી (Streaked Fantail Warbler) - ૪.

→ નાલિયા ગામ નજીક કુજ (Common Crane) તથા શુલાબી પેણ (Rosy Pelican) - ૨૦ જોઈ.

→ તા. ૧૦-૩-૨૦૦૨ના રોજ મેં તથા અચિન પોમલે ભુજથી ૧૫ ક્રિ. મી. દૂર આવેલાં દેવીસર તળાવ તથા રૂદ્રમાતા ડેમની મુલાકાત લીધી. પક્ષીનોંધ નીચે મુજબ છે.

રૂદ્રમાતા ડેમમાં કાખરી કારચિયા (Tufted Pochard) - ૧૦૦. દેવીસર તળાવમાં ગયણો (Shoveller) - ૨૦, લુધાર (Gadwall) - ૩, પિયાસણ (Wigeon) - ૧૫, નાની મુરઘાબી (Common Teal) - ૩૫, ટીલીયાળી બટક (Spotbilled Duck) - ૩૦, નકટો (Comb Duck) - ૧, ચેતવા (Garganey) - ૫, સર્પશીવ (Darter) - ૧, શેતપંખ જલમાંજર (Pheasant-tailed Jacana) - ૧, કુજ (Common Crane, ડિડ્ટી) - ૬૦, નાની કંકણસાર (Glossy Ibis) - ૩ વગેરે.

→ તા. ૨૮-૪-૨૦૦૨ના રોજ મુંદ્રાના દરિયાકિનારા નજીક પક્ષીનિરીક્ષણ કર્યું. મારી સાથે અચિન પોમલ, સુખોધ હાથી, ત્રિલોચન છાયા, ઈંબાહીમ દરવાઢિયા, ફીર મહમદ તુર્ક વગેરે હતા. અમે આસપાસના બંધોની પણ મુલાકાત લીધી.

મુંદ્રા બંદર ઉપર નાની વાબગલી (Little Tern) - ૨, મોટાં હજ (Greater Flamingo) - ૧૦, રેતચંડૂલ (Sand Lark) - ૩ વગેરે પક્ષીઓ જોયા.

મુંદ્રાના દરિયાકિનારે કુતલી ઢૂવો છે, ત્યાં નીચે મુજબ પક્ષીઓ જોયા.

મોટાં હજ (Greater Flamingo) - ૧૬, અબલખ (Oystercatcher) - ૧૫, કાળપેટ કીચડિયો (Dunlin, ઉનાળુ પોખાકમાં) - ૨, દરિયાઈ તુલવારી (Terek Sandpiper) - ૨, ખલિલી (Curlew, ઉનાળુ પોખાકમાં) - ૧, ધોળી વાબગલી (Gullbilled Tern) - ૩, નાની વાબગલી (Little Tern) - ૨, મોટી વાબગલી (Caspian Tern) - ૧, નાનો ગડેરો (Bartailed Godwit) - ૧, રાતાપગ (Redshank) - ૨, રાખોડી રાતાપગ (Dusky Redshank, ઉનાળુ પોખાકમાં) - ૧.

→ કુતલી ઢૂવો (મુંદ્રાના દરિયાકિનારે)

પર ભૂલામણી ઢોંગિલીનો માણો

અહીં ભૂલામણી ઢોંગિલી (Kentish Plover) ને

પાંખો અડધી બીડીને બેસતાં જોઈ. તેના આ વર્તનથી એમ લાગ્યું કે, અહીં તેનો માણો હોવો જોઈએ. અને ખરેખર તેનો માણો હતો! તેમાં ત્રણ ઠીડાં હતાં. આ અગાઉ એપ્રિલ, ૧૯૮૬માં તો. તેજ મુંદૂરે અહીં ભૂલામણી ઢોંગિલીના માળાની નોંધ કરી હતી. અમે જોયો તે સિવાય બીજા પણ માળા હોવાની શક્યતા છે.

→ ખેંગાર ડેમ (તા. મુંદ્રા) ઉપર ફાલીચાંચ ઢોક (Open bill stork) - ૩ તથા નાનો વનકશ્યો (Wood Shrike) જોયા.

→ ગજોડ ડેમ (તા. મુંદ્રા) ઉપર ગયણો (Shoveller) - ૨, સર્પશીવ (Darter) - ૨, મોટાં હજ (Greater Flamingo) - ૪ વગેરે પક્ષીઓ નોંધાં. ગયણાં, ઝતુ પ્રવાસમાં પાછી ગઈ લાગતી નથી.

→ કારાધોઢા ડેમ (તા. મુંદ્રા) ઉપર એક કાશ્મીરી વાબગલી (Whiskered Tern), ઉનાળુ પોખાકમાં જોઈ.

→ મુંદ્રા - ખેંગારસાગર ડેમ વચ્ચે ગાજ કપાસી (Blackwinged Kite) જોઈ.

→ તા. ૧૨-૫-૦૨ના રોજ અચિન પોમલ સાથે ઢોંસા તળાવ (તા. અંજાર) પર પક્ષીનિરીક્ષણ કર્યું. અગત્યનાં પક્ષીઓની યાદી નીચે મુજબ છે.

ચેતવા (Garganey, ઉનાળુ પોખાકમાં) - ૧, ગિરજા (Cotton Teal, ઉનાળુ પોખાકમાં), ગયણો (Shoveller, ઉનાળુ પોખાકમાં) - ૨૦, નાની સિસોટી બટક (Lesser Whistling Teal, ઉનાળુ પોખાકમાં) - ૧૨૪, ટીલીયાળી (Spotbilled Duck) - ૫૪, ભગતડાં (Coot) - ૬૭, કાળીપુંછ ગડેરા (Blacktailed Godwit, અમુક ઉનાળુ પોખાકમાં) - ૧૦, કાળપેટ કીચડિયા (Dunlin, ઉનાળુ પોખાકમાં) - ૨, શેતપીઠ કીચડિયા (Curlew Sandpiper, સંપૂર્ક ઉનાળુ પોખાકમાં) - ૨, નાના લીલાપગ (Marsh Sandpiper) - ૧, નાનો કીચડિયો (Little Stint, ઉનાળુ પોખાકમાં) - ૨૦, મોટાં હજ (Greater Flamingo) - ૧૨૦, નાની ઝૂભકી (Dabchik) - ૭૦.

## ନିର୍ବିକ୍ଷଣ ତାଂଦୀ

ગયણો, કાળીપૂંછ ગડેરો, કાળાપેટ કીચડિયો,  
શેતપીઠ કીચડિયો, નાનો લીલાપણ, નાનો કીચડિયો વગેરે  
શિયાળુ મુલાકાતી પદ્ધતિ મે મહિનાના મધ્ય ભાગ સુધી  
જોવા મળે છે, તે જાડી નવાઈ લાગી. તેઓ હવે પાછા જશે ?

→ તા. ૧૯-૫-૦૨ના રોજ દેવીસર તળાવની મુલાકાત લેતાં નીચેનાં પછીઓ જોયાં.

મોટા હળ (Greater Flamingo) -૮, નાની કંકણસાર (Glossy Ibis) -૩, ગયણો (Shoveller) -૨, ટીલીયાણી (Spotted Billed Duck) -૧૦, નાનો કીચડિયો (Little Stint) -૧, નાની ઢોંગિલી (Lesser Sand Plover, ઉનાણુ પોથાકમાં) -૩.

એ જ હિવસે ખારડિયા તેમ (તા. નખત્રાણા) પર બે કાશ્મીરી વાબગલી (Whiskered Term) ઉનાળુ પોથાકમાં જોઈ.

→ नलिया पासे काबरी रामचक्कली  
(Whitennaped Tit)

તા. ૨૪-૫-૦૨ના રોજ, આર.ડી.જાડેજા  
 (આર.એફ.ઓ.), કવિતેજ તથા અસ્થિન પોમલ સાથે નાલિયા  
 તથા તેની આજુઆજુના વિસ્તારમાં પક્ષિનિરીક્ષણ કર્યુ.

त्यांना कंटाणा झंगल विस्तारमां, बौया गाम  
नळक त्रुपा काबरी रामचकली (Whitewinged Black Tit  
or Whitenapped Tit) जोई. रायधणाईर रथालमां २००  
टपसिया (White - throated Munia) जोया.

→ ખોટા ચકવા (Great Stone Curlew)નું

ਪੰਜਾਬ

જ્યોતિ નશીકના મીઠાના અગરના પાણા ઉપર મોટા ચકવાનો માળો જોયો, જેમાં બે ઈડાં હતાં. તેના વાલી, કાગડાના હુમલાનો પ્રતિકાર કરતાં નશે પડયા.

→ તા. ૨૫-૫-૨૦૦૨ના રોજ જખ્યૌના મીઠાના અગરમાં નીચેનાં પક્ષીઓ જોયાં.

મોટી ચોटીલી ડુબકી (Greatcrested Grebe) -  
૨૨. શિયાળું નાની ડુબકી (Blacknecked Grebe) -

કાળીડોક ઢોક (Blacknecked stork) - ૨, મોટા હજ (Greater Flamingo) - ૪૦૦+, સર્પશ્રીવ (Darter) - ૭, વાધોમરી (SlendEerbilled Gull) - ૧, નાની વાબગલી (Little Tern) - ૪, નાના ગડેરા (Bartailed Godwit) - ૬૮, રાતાપગ (Red-shank) - ૧, લીલાપગ (Greenshank) - ૧, નાનો કીચારિયો (Little stint) - ૧, ઉલટીચાંચ (Avocet) - ૨, અબલખ (Oystercatcher) - ૪, કાળાપેટ કીચારિયો (Dunlin) - ૧૦ વગેરે. યાયાવર પક્ષીઓ હજુ જીવા મળે છે, તેથી આશ્રય થયું.

→ શિકારી પક્ષીઓ

ता. २५-५-०२ना रोज नविया तथा जपौमां एक-एक भगवी सभडी (Brahminy Kite), नविया - जपौ वर्च्ये त्रिण कुपासी (Blackwinged Kite) तथा रायधङ्गाजर गाम पासे चार भविया (Honey Buzzard) झेया.

→ તા. ૨-૬-૦૨ના રોજ એડમન્ડ લેક પર અસ્તીન  
પોમલ સાથે છાતુનો પ્રથમ ચાતક (Piedcrested Cuckoo)  
જોયો.

અહીં નહીની બેખડમાં કેચીપુંછ તારોડિયા (Redrumped Swallow)ના ૫-૬ માળા જોયાં. દસેક પક્ષીઓ ભાગાનજીક ઉડતાં હતાં.

→ હજુ યાયાવર પક્ષીઓ !

તા. ૮-૬-૦૨ના રોજ દેવીસર તળાવ ઉપર એક ગયથો (Shoveller), બેરામિયા ડેમ (તા. અબડાસા)માં એક પિયાસશ (Wigeon) તથા બાલાચોક ડેમ(તા. અબડાસા)માં ત અને બેરામિયા ડેમમાં ૩૦ કાળીપુંછ ગડેરા (Blacktailed-Godwit) જ્યેણા.

→ મોટી શિયાળુ દુબકી (Greatcrested Grebe) ની સારી સંપ્રા

તા. ૮-૬-૦૨ના રોજ ભોડી શિયાળુ ઝૂબકીની નીચે  
મુજબ હજરી નોંધી. આમ આ પક્ષીઓ અહીં રોકાઈ ગયા  
દોય તેમ લાગ્ય.

બેરામિયા તેમ (તા. અબડાસા) - ૬, દેવસર તેમ (તા. નખત્રાણા)-૧૦. કાચલા તેમ (તા. લુજ)-૧૬, નિરોધાણ

## નિર્વિક્ષણ નોંધ

તેમ (તા. ભુજ)-૧, ભુખી તેમ (તા. નખત્રાણા) -૧.

તા. ૨૮-૭-૦૨ના રોજ કુકમા ગામ તળાવમાં બે મોટી શિયાળુ દૂબકી જોઈ.

→ ગ્રતુનાં પ્રથમ અવલોકનો

લેર તેમ ખાતે, શિયાળુ મુલાકાતી પાણીનાં તથા અન્ય પક્ષીઓની આ વર્ષની પ્રથમ અવલોકન નોંધ આ મુજબ છે.

રાતાપગ (Redshank) -૧, દરિયાઈ તુતવારી (Terek Sandpiper) -૨, ભૂલામણી ઢોંગિલી (Kentish Plover) -૧, શૈતપીઠ કીચડિયો (Curlew Sandpiper) -૧, વૈયા (Rosy Pastor) -૨૦, તુતવારી (Common Sandpiper) -૧, લીલી તુતવારી (Green Sandpiper) -૩ વગેરે.

અહીં સાંજે પાણી પીવા આવેલાં ૮ રંગીન બટાવડાં (Painted Sandgrouse) જોયાં.

શાંતિલાલ વરુ

જૂના વાસ, મંદિરવાળો ખાંચો, માધાપર, ભુજ ૩૭૦૦૨૦

જાગ્રત્ત



**ધર્મજ (જિ. ખેડા)ની આસપાસ પક્ષી-  
નિરીક્ષણ**

→ તા. ૧૦-૪-૦૨ના રોજ પેટલાદ પાસે રંગાઝપુરામાં, જ્યાં ગટરનું પાણી તળાવમાં આવે છે ત્યાં, એક જલમુરધી (Indian Moorhen) નો માળો જોયો. ત્યાં જ કાળા જલમંજર (Bronzwinged Jacana)ના ગ્રણ માળા જોયાં. તેમાંથી કુલ ૮ બચ્ચાં થયાં છે.

આ વર્ષ શિયાળામાં, પેટલાદના તળાવમાં ૧૦૦૦ ગથણા (Shoveller) હતા.

→ ધર્મજ પાસે જ્યાં માટી ખોદાય છે ત્યાં, બેખડ જેવું બને છે. અહીં નીલાપુછ પતરંગા (Bluetailed Bee-eater) ના ૫૦-૬૦ જેટલા માળા ૨૮-૪-૦૨ના રોજ જોયા. ગયા વર્ષ પણ આ માળા હતા.

→ એક રાજુ (Yellowthroated Sparrow) એ ગઈ સાલની દુકદુક (Coppersmith) ની બજોલમાં માળો કર્યો છે, જ્યારે દુકદુક બાજુની ડાળ ઉપર નવો માળો બનાવ્યો

છે. (ક્યાં?, ક્યારે ?, ક્યું જાડ ? વગેરે માહિતી ઉપયોગી છે. - સં.)

→ તા. ૨૩-૭-૦૨ના રોજ ધર્મજ-રણોલ રસ્તા ઉપર, લીમડાના જાડમાં વનલેલા (Jungle Babbler) નો માળો જોયો. તેમાં ચાતક (Piedcrested Cuckoo)નાં પણ બચ્ચાં હતાં. ચાતક વાલીઓ પણ આસપાસમાં ઊંચાં કરતાં હતાં. બચ્ચાં બહાર આવે પછી તેમની સંભાળ લેવા અથવા તેમને સાથે લઈ જવા માટે હશે.

→ તા. ૨૮-૬-૦૨ના રોજ ધર્મજમાં, લીલુડીના જાડમાં ટપકીલી નાચણ (Whitespotted Fantail Flycatcher)નો માળો જોયો. બે બચ્ચાં હતાં અને મા-બાપ બંને બચ્ચાંની સંભાળ રાખતાં હતાં.

→ તા. ૫-૭-૦૨ના રોજ ધર્મજમાં, મની પ્લાન્ટની વેલના પાનમાં દરજા (Tailor Bird) નો માળો જોયો. તેમાં ૪ ઇડાં હતાં. તેમાંથી બચ્ચાં નીકળ્યાં બાદ ધ્યાન જેણે તેવી બાબત એ હતી કે, મોટે ભાગે નર જ બચ્ચાને ખવડાવવા આવતો.

→ ધર્મજ રણોલીના રસ્તે, એક ખેતરમાં, ઘાણિયા ઉપર, ફૂટી લેલી (Rufousbellied Babbler) નો ઘાસનો (મુનિયા જીવો) માળો હતો. ૧૩-૭-૦૨ થી ૧૮-૭-૦૨ સુધીમાં દરરોજે એક, અભે ચાર ઇડાં મૂક્યાં. બીજા ૪ દિવસ પછી તે ઇડાં જોવા મળ્યાં નહીં. એટલા વિસ્તારમાં નોળિયો ફરતો હોવાથી કદાચ તે ખાઈ ગયો હોય એમ લાગ્યું.

→ તા. ૧૫-૭-૦૨ના રોજ ફડક ફૂટી (Ashy wren warbler) નો ગવારના છોડમાં માળો જોયો. તેમાં બે બચ્ચાં હતાં.

→ તા. ૧૭-૭-૦૨ના રોજ મોટી ટોકરી (Kwânt-છોટા ઉદેપુર પાસે) પાસે ખોરડીના છોડમાં નાની ફડક ફૂટી (Plain Wren-Warbler) ને માળો બનાવતા જોઈ. ઘાસની પચીમાંથી માળો બનાવતી હતી. થોડે દૂર મોગરાના મોટા છોડમાં પીળી આંખ લેલા (Yellow - eyed Babbler) નો માળો જોયો.

→ પીળક સાથે પનારો

તા. ૧૫-૭-૦૨ના રોજ પહેલી વખત પીળકનો

માળો જોયો. બચ્ચાં થઈ ગયાં હતાં. બાવળનું જાડ હતું. તેની ઝુલેલી ડાળીનાં છેડે માળો બનાવ્યો હતો. તે જ જાડ પર કાકડિયો કુંભાર (Crow Pheasant) પણ માળાની તૈયારી કરતો હતો. તેની અને કાગડાની નજર બચ્ચાં પર પડી હતી, પરંતુ પીળકનો નર તેને પાછળ પડી ઉડાડી દેતો, તેથી વાંધો આવ્યો ન હતો. ૨૦-૭-૦૨ના દિવસે કાગડાએ પીળકના માળા ઉપર ઊડવા માંડયું, આથી મને, તે બચ્ચાં ખાઈ જશે તેવું લાગ્યું. કદાચ બચ્ચાં થોડાં મોટા થયાં હતાં, તેથી વાલી ત્યાં હતાં નહીં. મેં કાગડાને ઉડાડી દીધો. પછી એક વાંસ કે જે જાડ પરથી જાંબુ ઉતારવા માટે ઉપયોગી થાય છે, તે મંગાવી, તે મૂકી, એક નાના છોકરાને ઉપર ચઢાવી, બચ્ચાં ઉતારી લીધાં. માળો પણ ડાળી સાથે ઉતારી લીધો, જેથી બચ્ચાં તેમાં જ રહી શકે. તે દિવસે તો સાંજ પડી હતી, જેથી થોડાં ફૂદાં, પતંગિયાં અને કેરી ખવડાવીને બચ્ચાં રાખ્યાં. ત્યાર બાદ, શ્રી બી. એમ. પારાશર (આંશંદ) તથા શ્રી ઉદ્યુભાઈ વોરા (ગાંધીનગર) સાથે આ બચ્ચાં વિશે વાત કરી થોડી સલાહ લીધી. આ જાતુમાં તીડ, ફૂદાં વગેરે ખૂબ પ્રમાણમાં મળતાં હોવાથી બચ્ચાં માટે ખોરાક મેળવવાનું સહેલું પડ્યું.

તા. ૨૧-૭-૦૨ની સવારે માળો હતો તે જગ્યાએ બચ્ચાંને લઈ ગયો. તેની મા (Female) ત્યાં હતી, પરંતુ તે આવીને ઊડી જતી. સવારના ૭ થી ૮ વાગ્યા સુધી પ્રયત્ન કર્યો કે સુરક્ષિત જગ્યાએ માળો મૂકીએ અને તે ખવડાવી જાય, પરંતુ સવારે સફળતા ના મળી. ફરી ફૂદાં, પતંગિયા વગેરે ખવડાવ્યું. ઘરેલાવી કેરી ખવડાવી. બપોરે ફરી ૧૨-૩૦ વાગ્યે તેને બાવળમાં, તેનો માળો હતો તે જગ્યાએ લઈ નાંસો અને તેની માને ખબર પડી કે બચ્ચાં અહીં મૂક્યાં છે. તે તરત જ આવી. અમે થોડું અંતર રાખીને ડાંડાએ કે બીજું શિકારી પક્ષી આવી ના જાય તે કાળજી રાખતાં હતાં. મા માળા ઉપર પ્રથમ આવીને જોઈ ગઈ કે, બંને બચ્ચાં બરાબર છે. પછી તરત ગુંદાના જાડમાંથી મોટી ઈયણ (૨.૫ થી ૩ ઈય) પકડી લાવીને બચ્ચાંને ખવડાવી. ત્યાર બાદ,

બે-ત્રણ વખત ખવડાવ્યું પણ કાગડો ચક્કર મારતો હોવાથી સુરક્ષાની દાઢિએ, બચ્ચાં સાથે જ માળો મેં ગાડીમાં, તેમની માને ટેખાય તેમ મૂક્યો. થોડી વાર મહેનત પડી, પરંતુ તેમની મા આગળના કાચ ઉપર બેસી જતી. પછી તેને ઘ્યાલ આવી જતાં ગાડીમાં આવીને ખવડાવી જતી. આથી અમારી મુશ્કેલીનો અંત આવી ગયો. બે વખત તેની મા ખવડાવી જતી, સવારે ૭ થી ૮ અને બપોરે ૧૨-૩૦ થી ૪-૩૦. એ બે સમયે બચ્ચાંને માળામાં રાખીને લઈ જતાં. બાવળના જાડ પાસે તો આ બે વખતમાં ઘણી બધી વાર આવીને ખવડાવી જતી. બચ્ચાંની ચરક મારા હાથથી કે નાના ચિપિયાથી કાઢી લેતો, તેથી માળો ચોખ્યો રહેતો.

રાત્રે ઘણી વખત માળો બગડે નહીં તે માટે માળામાં ‘ટીસ્યુ પેપર’ મૂક્યો. સવારે કાઢી લેતો. બચ્ચાંનો વિકાસ ખૂબ જડપી હતો. ખોરાક બરાબર મળતો. પહેલા બે દિવસ, બચ્ચાં જયારે ખાવા માટે ચાંચ પહોળી કરતાં ત્યારે જ ચી.ચી. કરતાં, પરંતુ ત્રીજા દિવસથી તો બચ્ચાં ટી-ટું-ટી-ટું બોલવાં લાગ્યાં અને કલરવ કરવાં લાગ્યાં. હું તેમને બરાબર ખવડાવી દેતો. જેવું કેળું કે કેરી તેમનાં પેટમાં પડતાં કે વજન લાગતાં તે બોલવાનું બંધ કરી આંખો મીચી બેસી રહેતાં. મને ઘ્યાલ આવ્યો કે તેમના વૃષ્ણિના સમયમાં તેમને કેટલાં બધાં પ્રમાણમાં ખોરાક જોઈએ છે !

હવે મારો રોજનો કમ થઈ ગયો. સવારે ૬-૩૦ કે ૭-૦૦ વાગ્યે હું પીળકનાં માળાની જગ્યાએ પહોંચ્યો તો મા રાહ જોઈને બેસતી અથવા થોડી વાર માળો લઈને ફરતો તો તે આવી જતી. હું અને મધુભાઈ ઠકોર (ભગત) એક નાના આંબાની અંદરની ડાળીઓમાં તે માળાને બાંધી દેતાં. તે તરત જ ખવડાવવાનું ચાલુ કરી દેતી. આમાં એક ગૂંત અમે નોંધી. બે-ત્રણ વખત જલ્દી ખવડાવી પછી તે દૂર, મોટું તીડ કે પછો હંડાં જોખવા જતી રહેતી અને ઘણી વાર અડધો અડધો કલાક પછી પાછી આવતી. ગુંતું અમારો આ કમ સતત ચાલતો. તેમાં એક દિવસ બુધવારે ૨૩-૭-૦૨ના રોજ બે માદા પીળક વારા ફરતી

ખવડાવતી નોંધાઈ. એક પછી એક ખવડાવ્યાં જ કરતી. ઘડી વખત કાગડો કે પછી ઘૂંકિયો (Crow Pheasant) દેખાય તો વાલીઓ પાછળ પડીને ઉડાડી દેતાં. ક્યારેક ગજ પીળક એક નર અને બે માદા આવતાં, પરંતુ ત્યાર પછીના બે દિવસોમાં (શુરૂ, શુક : ૨૪, ૨૫ જુલાઈ) ફક્ત એક જ માદા આવી. કાગડાને ઉડાવાનું કામ અમને સોંપી દીધું હોય એવું લાગ્યું!

રહમીએ સવારે માદા પીળક ના દેખાઈ. જ્યાં દૂર પીળક દેખાય કે અમે દોડતાં ત્યાં પહોંચી જતાં, પરંતુ અમારો મેળ પડતો નહીં. પરંતુ પછી બપોરે, એક આશાનું સોનેરી કિરણ જળકું હોય તેમ તે આવી, તેથી મને જરા સંતોષ થયો કે હવે પાછો વાંધો નહીં આવે.

બચ્યાં આટલાં દિવસમાં માળાની બહાર આવવાનો પ્રયત્ન કરતાં ક્યારેક બહાર આવી પણ જતાં અને થોડું ઊડવાનો અને અહીંથી ત્યાં જવાનો પ્રયત્ન કરતાં હતાં.

પરંતુ મેં વિચાર્યું હતું કે, એક દિવસ પછી સુરક્ષિત જગ્યાએ બચ્યાં મુક્કીશ જેથી થોડું થોડું બચ્યાં ઊડતાં થયાં હોય તો તેને મોટાં કરવા અને લઈ જવામાં પીળકને વાંધો ના આવે. આથી રહમીએ ફરી સવારે ગયો, પરંતુ તેમની મા ના આવી. આ દરમયાન જગ્યારે જગ્યારે ભારે ખવડાવવું પડતું ત્યારે પતંગિયા, નાનાં જીવડાં, તીતીઘડા વગેરે લેગા કરીને ખવડાવતો. એક બે વખત બાફેલા ઈડાં નો પીળો ભાગ (જર્દા) ખવડાવ્યો હતો, આથી બચ્યાંનાં પોષણમાં ક્રોઝ વાંધો આવ્યો નહીં. બચ્યાંનો વિકાસ ખૂબ જરૂરી થઈ ગયો હતો. તેથી દેખાવમાં પણ મોટાં લાગતાં. અને તેમાનું એક બચ્યું તો ખૂબ ઊડ-ઊડ કરતું હતું. આમ, બસે ઊડતાં.

રહમીએ બચ્યાંની માને શોધવાની ખૂબ તકલીફ પડી, પણ એટલામાં તે આવી. અમે ખૂબ આનંદમાં આવી ગયાં. પછી દરરોજના કામ મુજબ આંબાનું ગાંઠાં ઉપર બચ્યાં મૂક્યાં. ત્યાં ખૂબાં ખૂબ જંબુના ઘટાદાર વૃક્ષ પર મૂક્યાં કેળા બીજા પણીની નજરમાં ના આવે. દૂરથી તેમનું ધ્યાન

રાખતાં હતાં, જેથી તેની મા, બચ્યાં સાથે વધુ સમય રહી શકે.

અમારે તેને ભાન કરાવવાનું હતું કે, અમે બચ્યાંને તને સોંપવાના છીએ અને તેની સંપૂર્ણ જવાબદારી તારે નિભાવવાની છે! અમે બચ્યાંને પાછળ લઈ જવાનાં નથી. અમે વધુને વધુ દૂર જઈને તેઓ દેખાય તેમ બેઠાં. મા વધુ સમયસર ખવડાવવા માંડી. બચ્યાં પણ ડાળીમાં ઉપરની તરફ જવા લાગ્યાં. ત્યાર બાદ, મેં ગાડી કાઢી, રોડ ઉપર લાવી બેઠા. જેવી તેની મા તેને ખવડાવવા લાગ્યી કે અમે ત્યાંથી નીકળી ગયાં, જેથી તેની મા એમ ના સમજે કે તેઓ બચ્યાંને ગાડીમાં લઈ જશે !

સાંચે ફરી તપાસ કરી તો મા-બાપ તેની સંભાળ રાખતાં હતાં. બીજે દિવસે રહમીએ પણ સવારે ગયો હતો. એક બચ્યું જે વધુ ઊડતું હતું તે દેખાયું નહીં, જેથી એમ લાગ્યું કે તે ઊડી ગયું હશે. બીજું બચ્યું હતું. તે ત્યાં નીચે બેઠું હતું. તેની મા તેની પાસે આવી. તેની સંભાળ લેતી જોઈ, આથી મને સંતોષ થયો.

યજોશ ભંડ  
આજાદ ચેક, કર્મચારી, જિ.આર્ટિંડ ૩૮૮૪૩૦



બચ્યાં ઊછેરમાં માદા પીળક વધુ સક્રિય

વઢવાણ, વિકાસ વિધાલયમાં પીળક (Golden Oriole) નો માળો હતો (ક્યા વૃક્ષમાં ? - સ.). તેમાંથી બે બચ્યાં ઊછરીને મોટાં થતાં જોયાં. ઊછેરમાં માદાનો મહત્વનો ફાળો હતો. પિતા મોટે ભાગે ચોકી કરવાનું કામ કરતો. અમારા અવલોકનમાં માતા હ વખત ખોરાક લાવતી ત્યારે પિતા એક વાર ખોરાક લાવતો.

બોગેડ્ઝ સંસ્કરણ, ગુરુ દારા, ફાર્ક ચૌહાણ, મહાવીર પરમાર

સુરેન્દ્રનગર





### દાહોદમાં ચિલોન્ડો (Grey Hornbill)

એક દિવસ મારા મિત્ર જુજરે દાહોદથી ૮ કિ.મી. દૂર ચૌસાલા મુકામે ચિલોન્ડો જોવાની જાણ કરી. બીજે દિવસે તા. ૨૪-૪-૦૨ ના રોજ અમે તે સ્થળની મુલાકાત લીધી. અમે ચિલોન્ડો જોયો. પહેલી જ વાર દાહોદ નજીક આ પક્ષીની નોંધ થાય છે, તે વિચારે નાચી ઉઠ્યાં. રિજટલ વિડિયો કેમેરાથી તેનું ચિત્ર ઉતાર્યું. દાહોદ પરત થતા રસ્તામાં ૪ બદામી રણગોધ્યલા (Indian Courser) જોયાં.

તા. ૭-૭-૦૨ ના રોજ દાહોદથી ૧૭ કિ.મી. દૂર કંબોઈ મુકામે ૪ મોરગાંડમ (Crested Bunting) જોયાં, બે નર અને બે માદા. અહીંથી તે વીરલ નથી, એનું દાહોદના શ્રી અજ્યભાઈ દેસાઈ (પ્રકૃતિમંડળ) એ જણાવ્યું.

શાકીર કરીવાલા

દાહોદ



### નાયકામાં રાજહંસ

તા. ૩૧-૧૨-૦૧ ના રોજ મૂળી પાસે નાયકામાં મુલાકાત લીધી. સિંચાઈમાં વપરાવાને લીધે ધાર્યા કરતાં પાણી વહેલું ખલાસ થઈ ગયું હતું. પાણી ઓછું હોવાને લીધે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ યાયાવર પક્ષીઓની સંખ્યા ઓછી હતી. તા. ૩-૧-૦૨ ના રોજ સવારે સાત વાગ્યે ૧૮ રાજહંસ (Barheaded Geese) ઉત્તરથી દક્ષિણ બાજુ ઉત્તી જતાં જોયાં.

→ કુંજ અને વૈયાની નિયમિતતા

હું છેલ્લાં સાત વર્ષથી અમારા વિસ્તારમાં કુંજ તથા વૈયાના આગમન અને વિદાયની નોંધ રાખું છું.

સાફેભર માસની ૨૭ થી ૨૭ તારીખ સુધીમાં અમુક કુંજ આવી ગઈ હોય છે. આ વર્ષે પણ અમારા લીપા ગામની સીમમાં તળાવ કંઠે તા. ૨૭ સપ્ટે. ના રોજ ૪૦૦ની સંખ્યામાં કુંજ જોઈ. તેઓ માર્યની ૧૮ થી ૨૪ તારીખ

સુધીમાં છેલ્લી વિદાય લે છે.

વૈયાં ૨૭મી જુલાઈથી આ વિસ્તારમાં આવતાં દેખાય છે. તેઓ આઢેક મહિનાનો સમય અહીં ગાળે છે અને માર્યના અંતમાં દેખાતાં બંધ થાય છે. આમ ચાર માસ તેઓ પ્રજનન અર્થે ઉત્તરમાં ઠડા પ્રદેશોમાં જાય છે.

→ ગીરમાં ઈન્દ્રરાજની બીજી નોંધ !

તા. ૧૨-૧-૦૨ થી ૧૪-૧-૦૨ દરમિયાન ગીરમાં, અધોડિયા શિબિરસ્થળ ખાતે યોજાયેલા પ્રકૃતિ શિબિર દરમિયાન, અધોડિયાથી કમલેશ્વર બંધ જવાના રસ્તે, વાલોધરા નાકા પાસે જ્યાં જણ વહેણ ભેગાં થાય છે, ત્યાં ઈન્દ્રરાજ (Malabar Whistling Thrush) જોયો.

શ્રી લાલસિંહ રાઓલના વન-ઉપવનમાં પંખીના પાન નં ૧૨૮ ઉપરની માહિતીના આધારે તે ઈન્દ્રરાજ હતો તેમ નક્કી કર્યું. તેમ છતાં રંગીન ચિત્ર નહીં હોવાથી મારી શંકા દૂર કરવા મેં ‘પિકોરિયલ’ના પાન. નં. ૧૪૦ ઉપર પ્લેટ ૮૩ ઉપર આપેલા રંગીન ચિત્ર સાથે જોયેલા પક્ષીને સરખાવી ખાત્રી કરી લીધી.

આ પહેલા વડોદરાના શ્રી રોહિત વ્યાસે ૧૯૮૮માં ગીરમાં આ પક્ષીની નોંધ કરી હતી તથા તસવીર લીધી હતી, જે અંગે ‘વિહુંગ’ ૨૦૦૦ ગ્રીભ, સંંગ અંક-૮માં અહેવાલ અપાયો હતો. એ રીતે જેતાં મારી ઈન્દ્રરાજની અવલોકન નોંધ ગીર ખાતે બીજી નોંધ કહેવાય.

કિશોરંગ રાવળ

જૂના બસસેન્ટ પાસે, બ્રાબન્શ બ્રોજનાલયની બાજુમાં, મૂળી ૩૬૩૫૧૦



### પરિઅેજ ખાતે પક્ષીનિરીક્ષણ

તા. ૧૪-૭-૦૨ ના રોજ શ્રી રોહિત વ્યાસ સાથે પરિઅેજ જળાશય ખાતે પક્ષીનિરીક્ષણ કરતાં બે મોટી ચોટીલી દૂબકી (Greatcrested Grebe) તથા ૪૦૦ લગતડાં (Coot) જોયાં. આ ઉપરાંત અન્ય ૪૦ જાતનાં

પક્ષીઓ હતાં.

તા. ૨૧-૭-૦૨ ના રોજ ધુવારણ ખાતે  
પક્ષીનિરીક્ષણ કરતાં અન્ય પક્ષીઓ સાથે આશરે ૨૬  
ખલિલી (Curlew) જોઈ.

→ ભીમરાજ વડોદરાની મુલાકાતે !

તા. ૨૮-૫-૦૨ના રોજ વડોદરાથી ૮ કિ.મી.  
દૂર સેવાસી ગામે, 'ફાર્મ હાઉસ' ઉપર મારું કામ ચાલી રહ્યું  
હતું. ત્યાં મહી નદીનાં કોતરો આવેલાં છે. ત્યાંના મજૂરો  
સાથે ઊભા રહી, વાદળ જોતાં જોતાં, વરસાદની વાતો કરતાં  
હતાં. તે વખતે દૂર પશ્ચિમ દિશા તરફથી એક કાળું પક્ષી  
આવતું, નજરે ચક્કું. આવી રહેલા પક્ષીને કાળો કોશી  
(Black Drongo) સમજી તેની ઊદાં જોવામાં મશગુલ હતો.  
તે અમારા માથા ઉપરથી, સોએક કૂટ ઊંઘેથી પસાર થયું.  
જોતાં એ કોશીના પાછળના ભાગમાં બે વાયરના છેડે પોંછાં  
જગ્ઝાયાં. તરત ઓળખ્યું કે, "આ તો ભીમરાજ (Racket-tailed Drongo)." તેને મળતું આવતું બીજું કોઈ પક્ષી  
ગુજરાતમાં નથી એટલે ભૂલ થવાનો સંભવ ન હતો.

આ પહેલાં ડિસેઝરમાં ત્રણથી ચાર ભીમરાજ ડાંગમાં  
જોવા મળ્યાં હતાં. તે નજીકના કોઈ જાડ પર બેઠા વિના દૂર  
દૂર જતું રહ્યું.

### કાર્તિક ઉપાધ્યાય

એ-૮, સુષ્ટિ ફ્લેટ્સ, સુર્યદર્શન સામે, માંજલપુર, વડોદરા ૩૮૦૦૧૧



### શક્કરખોરાનું વર્ણસ્નાન !

ગયા ચોમાસા દરમિયાન, આંગણામાં જાસુદનાં  
ફૂલોમાંથી રસ ચૂસવા આવતા શક્કરખોરામાંથી એક,  
ધોખમાર વરસાદને કારણે વહેતા પાણીમાં પડી ગયું. તેની  
પાંખો ભીજાઈ જવાથી ઊરી શકતું ન હતું. મેં સમાચાર  
પત્રના ટુકડાઓ વડે પાણી શોધી તેને કોરું કર્યું અને ઊડતું  
કર્યું. શક્કરખોરાને દાથમાં લઈ નિરખવું એ મોટા ઈનામ

જવું હતું ! એને જોઈને કુદરતની કરામતનો ખ્યાલ આવે !  
તે વખતે મધ્યમાં આંગળી ડૂબાડી તેની સામે ખરતાં તે પોતાની  
પાતળી જીબ વડે ચપ-ચપ ચાટી જતું હતું, તે જોવાની ખૂબ  
મજા પડી હતી.

W.W.F., અતુલ તરફથી પ્રકૃતિશબ્દિરોમાં ભાગ  
લઈ પક્ષીઓનો અભ્યાસુ બન્યો. એ પવિત્ર જ્યોતમાં  
'વિહંગ' જાગો ધી ઉમેરવાનું કામ કર્યું. આને પ્રતાપે આજે  
મારા જેવા કેટલાયે નવા પક્ષીનિરીક્ષકો બનતા જાય છે.  
આ માટે 'વિહંગ' ને ખૂબ ખૂબ અભિનંદન !(૨૦-૪-૦૨  
નો પત્ર)

ચિરાગ  
નવસરી



### કાગડાનું એકોબેટીક્સ!

તા. ૧૪-૬-૦૨ના રોજ સવારે વેરાવળના ખૂનિ.  
બગીચામાં એક અદ્ભુત દશ્ય જોયું ! એક કાગડાએ ઊડતા-  
ઊડતા જ એક ઊડતા પતંગિયાને બે પગ વડે પકડીને હવામાં  
જ તેની પાંખો ચાંચ વડે કાપીને ખાઈ ગયો !

ભગવાનજી જીવિયા

૧૬ બી, શક્તિનગર, ડાયોર રોડ, વેરાવળ-૩૬૨૨૬૬૬



### નણસરોવરમાં પક્ષીનિરીક્ષણ

→ નવે. '૦૧ના બીજા સમાંડમાં કરેલા પક્ષીનિરીક્ષણ  
દરમિયાન નીચે જણાવેલાં નોંધપાત્ર અવલોકન કર્યું. આ  
અવલોકનો જુદા જુદા વિસ્તારોમાંથી ૪ થી ૫ દિવસના  
સમયગાળા દરમિયાન લીધાં. જુદી જુદી પક્ષી જતિની  
વધુમાં વધુ નોંધાયેલી સંખ્યા જણાવેલી છે.

સિંગપર - (Pintail) ૫૦૦૦+, ગયડા (Shoveller) - ૭૦૦૦+, પિયાસણ (Wigeon) - ૨૦૦૦+, લુદાર

(Gadwall) - १५००+, નાની મુરઘાખી (Common Teal)

- ४००+, રાખોડી કારચિયા (Common Pochard) - ३००+, ચેતવા (Garganey) - ५००, ભગતડાં (Coot) - એક લાખથી વધારે, નાના કાંજિયા (Little Cormorant) - १०००, મોટા તેજપર (Collard Pratincole) - ५००+, નાના તેજપર (Little Pratincole) - २००+, મોટા હંજ (Greater Flamingo) - ४५०, નાનાં હંજ (Lesser Flamingo) - १००, નાની કંકણસાર (Glossy Ibis) - १५० વર્ગરે.

→ ડિસે. '૦૧ના છેલ્લા સમાહમાં નળસરોવરમાં ૧૫૦૦ થી ૨૦૦૦ હંજ (Common Crane) દેખાતી હતી. આ ઉપરાંત ૩૮૦ ગાજહંસ (Greylag Goose), ૧૦૦૦+ કાળીપૂછ ગડેરા (Blacktailed Godwit), ૧૫૦૦ મોટાં હંજ (Greater Flamingo), ૩૦૦ ફાટીચાંચ ઢોંક (Openbill Stork), ૨૦૦ નાની કંકણસાર (Glossy Ibis), હજારોની સંખ્યામાં જુદી જુદી બતકો (Ducks) તથા લાખથી વધારે ભગતડાં જોવા મળ્યાં હતાં.

→ તા. ૧૩-૧-૦૨ના રોજ ચાણાગઢ પાસેના શિયાળ બેટ ઉપર જતાં ૩૦૦૦ ગાજહંસ (Greylag Goose) જોવા મળ્યા.

→ તા. ૧૧-૧-૦૨ના રોજ નળસરોવર ગેસ્ટહાઉસની ઊગમણી દિશા તરફ એક બાવળમાં ૧૧ રણ બુલબુલ (Whitecheeked Bulbul) જોઈ. તેમાં એક બુલબુલ જુદી લાગી, જે Himalayan Bulbul સાથે સાચ્ચ ધરાવતી હતી, તો આ વિસ્તારમાં તે વીરલ રખું (rare vagrant) તરીકે આવી શકે ?

→ તા. ૧૮-૪-૦૨ના રોજ નળસરોવરમાં થોડા ધણાં મોટાં હંજ તથા નાનાં હંજ, ગડેરા, થોડી બતકો જોવી કે, ચેતવા અને પિયાસણ, ભગતડાં વર્ગેરે જોયાં. આ ઉપરાંત, મને આશ્ર્ય એક સફેદ ઢોંક (White Stork)ની હાજરીનું થયું ! આટલી ગરમીમાં અહીં કેમ ? આ પહેલા એપ્રિલ

મહિનામાં મેં તેને નળ સરોવર પાસે જોયો નથી.

→ નળ સરોવરમાં શૈતપૂછ ટિટોડી (White-tailed Lapwing)નો માળો

વનખાંતાના આવાસો પાસે નહેર આવેલી છે. આ નહેર પાસેના નળસરોવરના કિનારે તા. ૭-૫-૦૨ના રોજ સવારે ૮-૩૦ વાગ્યે શૈતપૂછ ટિટોડીનો એક માળો જમીન ઉપર જોયો. માળામાં ૪ હંડા જોવા મળ્યાં. તા. ૨૮-૫-૦૨ના રોજ મેં ફરી તપાસ કરી તો માળામાં એક હંડું હતું. હું માળાથી દૂર બેસી બાકીના હંડાનું શું થયું હશે, તે વિચારતો હતો. એટલામાં બે શૈતપૂછ ટિટોડીઓ (મા-બાપ) એ આવીને મારા પર હુમલો કરવાનો શરૂ કર્યો. હું દૂર જતો રહ્યો. બંને ટિટોડી જતી રહ્યી.

હું ધીરજ રાખી દૂરબીન લગાવીને બેઠો. દૂર મને બંને ટિટોડી વચ્ચે એક નાનું બચ્ચું દેખાયું. ધ્યાનથી જોયું તો કુલ ત્રણ નાનાં બચ્ચાં હતાં. મેં શ્રી લાલસિંહ ભાઈના પુસ્તક 'પાણીના સંગાથી'માં વાગ્યું હતું કે, "શૈતપૂછ ટિટોડી અહીં શિયાળ પૂરતી જ આવે છે અને વસંત રાતુમાં માળા કરવા વિદેશ ઉપરી જાય છે."

શું આ યાયાવર શૈતપૂછ ટિટોડીનું અહીં રોકાણ, માળો તથા બચ્ચાંઓહેર નોંધપાત્ર ના કહેવાય ? !

→ તા. ૨૩-૭-૦૨ના રોજ સવારે ૮-૩૦ વાગ્યે વેકરિયાથી નળસરોવર સાઈકલ ઉપર જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા પાસે આવેલી નહેરમાં ઉપર ઊડતી કેંચીપૂછ વાબગલી(Indian River Tern) પર નજર પડી. આ વાબગલી સાથે પાણીની સપાટી પર ઊડતાં બે જળહળ (Indian Skimmer) પણ જોયાં. નળસરોવરમાં આ અગાઉ દસેક વર્ષો પહેલાં મેં બે જળહળ જોવા હતાં. ધણાં વર્ષો પછી મને ફરી જોવા મળ્યા.

કાસમ સમા

વેકરિયા, નળસરોવર



## હિંગોળગઢમાં નવરંગનો માળો

હિંગોળગઢ અભયારણયના કર્મચારીઓ શ્રી બાલાભાઈ અને શ્રી શાનુભભાઈ જેબલીયાએ જણાવ્યા મુજબ, જુલાઈની શરૂઆતમાં હિંગોળગઢ ખાતે ભીમુકૃદ્ધ પાસે નવરંગે અન્ય પક્ષીનો માળો જ્યાં હતો તે આસન (Platform) ઉપર પોતાનો માળો બનાવી ઈડાં મુકેલાં, પણ ઘૂંકિયો (Crow Pheasant) માળો વીજીને આ ઈડાં ખાઈ ગયેલ. ૨૭ જુલાઈ, ૨૦૦૨ના રોજ હિંગોળગઢ ગયો ત્યારે, આ માળાનાં અવશેષો હરમાના ઝડ પર જોયેલા. કદાચ અગાઉનો માળો પણ ઘૂંકિયાએ લુંટ્યો હશે, જેથી નવરંગનો માળો શોધવામાં તેને સહેલું પડ્યું હોય ! શ્રી લવકુમાર સાહેબે પણ હિંગોળગઢમાં નવરંગ ઘણાં બધાં આવ્યાં છે, તેમ જણાવ્યું.

### જયદેવ ધાધલ

૬૨, જવાહર સો., કોલેજ રોડ, મહુવા-૩૬૪૨૬૦

અનિલ



## રાખોડી અબાબીલ-લટોરા (Ashy Swallow -low - Shrike) નું નિરીક્ષણ

તા. ૩૦-૭-૨૦૦૧ રવિવારને દિવસે સાંજે પાંચેક વાગ્યે હંગ (મહલ)થી સુરત પાછા ફરતા હતા ત્યારે, વારાની નજીક વાલોઠા ગામ પાસે રસ્તાથી પચાસેક મીટર દૂર વીજળીના તાર પર પાંચ પક્ષીઓ બેઠેલાં હતાં. કદ અને આકાર પરથી કંઈક નવાં જણાયાં. ગાડી રોકી, ધીમે પગલે ચાલતા જઈ દૂરભીન ગોઠવ્યું. બરાબર નિરીક્ષણ કર્યું અને જાડ્યું કે આતો રાખોડી અબાબીલ-લટોરો છે. ધીમે ધીમે ખૂલ જ નજીક પહોંચ્યો. વ્યવસ્થિત નિરીક્ષણ કર્યું. ઉપરનું શરીર ધેરા રાખોડી રંગનું, પેટ મેલા ધોળા રંગનું, પૂછડી ટૂંકી અને તેનો સર્કદ છેડો સ્પષ્ટ જીથાં. પૂછડી કરતાં પણ પાંચની લંબાઈ મોટી જણાતી હતી. ચાંચ દૂષિયા (આઇ ભૂરો) રાખોડી રંગની તેમજ આંખો....કાળી.

આટલું, જીણવટભર્યું નિરીક્ષણ કરી ડાયરીમાં નોંધ્યું. આ પક્ષીઓ નિર્ભય થઈ બેઠાં હતાં, આ પરથી આ પક્ષીઓ ઓછાં શરમાળ જણાયા.

'Birds of the Indian Subcontinent' by Grimmet, Inskip, Inskip માં કાયમી રહેઠાડા વિસ્તાર ગુજરાતમાં દર્શાવેલ નથી, પરંતુ બ્યક્સિલગત નોંધ બતાવેલી છે. 'Krys Kazmierczak' ના 'Birds of India' મુસ્તકમાં પણ આવી જ માહિતી છે, પરંતુ શ્રી લાલસિંહભાઈ રાઓલના 'વન, ઉપવનનાં પંખી'માં દર્શિશ ગુજરાતમાં હોવાનો ઉલ્લેખ કરેલ છે અને અવ્યાપક દર્શાવેલ છે.

ઉપરોક્ત પક્ષીઓ આજથી બે વર્ષ પહેલાં, બરાબર આજ સ્થળે, તાર પર બે ની સંખ્યામાં જોયેલ.

અનિલ એન. ભક્ત

અ-૩, કાર્ટિક પાર્ક, નવયુગ કોલેજ પાછળ, જોગાશીનગર પાસે, રાંદેર રોડ, સુરત



## Birdlife Around Hingolgadh

After the initial rain which filled up the lakes and promised the commencement of a good monsoon, there has been no rain and July has almost gone without any rain. The SW monsoon wind is blasting across Saurashtra and so we can still hope for diluge when the wind stops for a few days.

It seems, Indian Pittas have become regular breeders here and I heard several birds calling in the ravines around the fort. In earlier years, though Pittas regularly put in appearances for a few days during summer they were known to regularly breed by circumstantial evidence only in the Gir. Dharmakumarsinhji had recorded a nest on Shetrunjaya but this bird was never a breeding bird with us. Whether we should rejoice at the regular nesting as improvement in the habitat or an increase in Pitta population are debatable. You will recollect I had some comments to be made

on the new presence of Blackheaded Cuckoo Shrike and the Brainfever Bird (Hawk Cuckoo) around Hingolgadh. As I had warned, the Cuckoo Shrike is no longer heard for the last two monsoons, and this year, the Cuckoo is far less audible. Is the increased presence of the Pitta then to be rejoiced over or seen as a warning of general environmental degradation in the region as a whole ?

The Small and Whitebellied Minivets, Marshal's lora and the Yellow-eyed Babbler which were so much delight of the Motisari Jungle around Hingolgadh have shown a drastic decline. Last year there was a significant fall in the numbers of Rosy Pastors, this year I have yet to see a single bird.

For the last few days a couple of hundred Cattle Egrets have joined the Pigeons in putting grand flight displays around the hills. They seem to have been attracted by an explosion in the population of small brown grasshoppers. In past years, it was the large flocks of Rosy Pastors (mainly juveniles) who feasted on these insects.

Talking of insects, there are hardly any being drawn to lights. We certainly have succeeded in sanitising the countryside. Very, very serious note must be taken of this drastic crash in insect populations. What with overgrazing, poor protection of reserved grasslands, destruction of hedgerows, near total shift of cultivation from millets to groundnut and cotton and increased use of inorganic manures and indiscriminate, almost compulsive spraying of pesticides, we are witnessing a mass extinction.

The ray of hope lies in the tenacious capability to make adaptations by birds. But, we cannot be casual, and must make our concerns taken notice of.(29th July' 02)

#### → Common Swallows in Hingolgadh

For the last week thousands of Common

Swallows (*Hirundo rustica*) have been appearing in the late afternoons around Hingolgadh. They all seem to be leisurely flying towards the west, feeding as they go. I presume, these are on passage migration towards South Africa. All the birds are pure white below suggesting they belong to the eastern subspecies which breeds during summer in China and beyond further north in Manchuria. I am now keeping an alert for the western race. Both races winter throughout India and in good plumage can be identified by the white underparts of the eastern subspecies contra a pinkish tint in the western. Normally, Common Swallow hunts low over wetgrass, crops and water as well as over the sea around mangrove islands in the Gulf of Kachchh. These flocks, passing Hingolgadh are flying higher presumably to avoid the strong surface winds contrary to their direction of flight, at the same time taking advantage of insects rising in the updraft turbulances above the air flow.

With the normally low flying Common Swallows hunting several hundred feet above ground level, the Redrumped Swallows which normally hawk insects by gliding are correspondingly operating higher. The House Swifts have food available still further up and are visible as tiny specks ! The Dusky Crag Martins continue to fly around the fort walls never venturing too far out or above. This sort of birdwatching is to be strongly recommended if a birdwatcher wishes to develop a 'feel' for his birds. This is what experience is all about - something that can through up concepts for scientific inquiry and understanding no timebound set of instructions can provide. Each amateur can aspire to become a Horace Alexander with his warblers at a glance or a Dharmakumarsinhji with his identification of a raptor in the distance.( 9th Sept.' 02)

**Lavkumar Khachar**

14, Jayant Soc., Rajkot-360004





## Northern Lapwing in Baroda Dist.: 1st record for Gujarat

On 26th January 2002, we were visiting Wadhwana irrigation dam near Dabhoi for waterfowl census. I had taken with me, students of M.Sc. Final Class with "Biodiversity, Wildlife Biology and Ornithology" as a special subject. We were a group of about 10 people. Wadhwana is visited by thousands of migratory birds during winter. Different species occur in large numbers too. While counting waders, one of the students saw a different coloured bird and immediately called me for identification. On the very first sight I recognised it to be Northern Lapwing. I had seen this bird at Timbi irrigation dam more than a decade ago. At that time I was the only person who saw it, as, before I could show it to others, it had flown away. As I was an amateur at that time, I had no confidence in reporting it, but now more than ten people have seen it. There was a pair and it was there on the next day too.

On discussion with other birdwatchers of Gujarat at Nalsarovar waterfowl census Feb. 2002 and from surveying the literature it seems that this is the first record (or rather second for myself) of Northern Lapwing (*Vanellus vanellus*) in Gujarat. I would like to know if any one else has seen this bird in Gujarat. It is reported to be a winter visitor to northern subcontinent, and there are probably couple of records from Maharashtra and M.P. This bird when observed was in winter plumage but still difficult to be mistaken for any other bird. I hope that Northern Lapwing visits Gujarat more frequently and many more birdwatchers are able to see this beautiful wader.

**Geeta Padate**

Zoology Dept., M.S. Uni., Vadodara



## સુરેન્દ્રનગરથી ગીર

અહીં સુરેન્દ્રનગરમાં ટી.બી. હોસ્પિટલ પાસે ગંદું પાણી ભરાય છે. તાં સારું એવું મોહું કાદવિયું મેદાન બની ગયું છે. ત્યાં ૨૩-૫-૦૨ના રોજ મેં પાનલવા (Painted Snipe) નાં ગ્રાનર તથા બે માદા જોયાં. માળાની તપાસમાં છું.

તા. ૧૪-૫-૦૨ના રોજ હું, યોગેન્ડ્ર શાહ તથા મહાવીરસિંહ પરમાર ગીર ગયા હતા. ત્યાં ટીસા (White-eye Buzzard) તથા હરિયલ (Green Pigeon)ના માળા સાગનાં વૃક્ષોમાં જોયા. બંનેના માળા વચ્ચેનું અંતર પમી. જેટલું હશે. બંને માળા અલગ અલગ વૃક્ષોમાં હતા. ટીસાના માળામાં ત્રણ બચ્ચાં હતાં જ્યારે હરિયલના માળામાં હડાં. હતાં. કેટલાં, તે દૂરથી નક્કી ન કરી શકાયું.

ઓ સિવાય, રાઈડીવાળા રસ્તે એક મત્સ્ય ઘુઘડ (Brown Fish-owl) તથા સાત નવરંગ (Indian Pitta) જોયા. સતત બે દિવસ અમે નવરંગનું સંગીત માઝયું !

શ્રી વોરા

લક્ષ્મીપુર, દૂરેજ રોડ, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧



## રાખોડી અબાબીલ (Ashy Swallow - Shrike) ની અવલોકન નોંધ

તા. ૧૩-૫-૨૦૦૨ના રોજ ચીખલીથી વાંસદાના રસ્તે, ચીખલીથી થોડે દૂર, એક સાદળના જાડ ઉપર બે પક્ષીઓ જોયા. મને લાગ્યું કે, આ પક્ષીઓ હું પ્રથમ વાર નિહાળી રહ્યો છું.

આ પક્ષીની ચાંચ જારી અને વાદળી રંગની તથા શરીર વેરા રાખોડી - બદામી રંગનું હતું. પૂછડી ટૂકડી હતી. તેમની ઉડાન પતરંગા (Bee-eater) જેવી હતી. પક્ષીનો અવાજ સાંભળવા મળ્યો નહીં.

સુરત આવીને શ્રી મુકેશ ભવને વાત કરતાં તેમણે

તે અભાલી લટોરો હોવાની શક્યતા જણાવી. પુસ્તકમાં જેતાં તેની ઓળખ પૂર્ણ થઈ.

સનમ પટેલ

૫૪, નિલકંઠ નગર, પેટ્રોલ પંપ સામે, ભાવર રોડ, સુરત

સાચા



### પીલગાઈનની માળાવસાહત

ચાલુ વર્ષ (૨૦૦૧) વરસાદની માત્રા સારી

હોવાથી ભાવનગરમાં દર વર્ષની માફક આ વર્ષ પણ શહેરની મધ્યમાં આવેલા ‘પીલ ગાઈન’ તથા તેની આજુબાજુનાં ઊચાં વૃક્ષો પર પીળીચાંચ ઢોંક (Painted Stork) ના માળા બન્યા. સોનમહોર (Pinted Stork), કમળકાડી, લીમડો, આંબલી વગેરે વૃક્ષો ઉપર કુલ ૨૭૦ માળાની ગણતરી કરવામાં આવી. તેમાં આશરે ૨૧૦ બચ્ચાં તથા ૩૩૫ પુખ્ખ પક્ષીઓ જોયા.

અમારી શાળામાં ‘નીલકંઠ પ્રકૃતિ મંડળ’ અંતર્ગત બાળકો દ્વારા ભાવનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં નિયમિત પક્ષીદર્શન થાય છે. ચકલી, કાગડા જેવાં સામાન્ય પક્ષીઓના માળાની પણ બાળકો દ્વારા ગણતરી થાય છે.

રાજેશ ત્રિવેદી

ઈકો ઓફિસર, સ્વામીનારાયણ હાઇસ્કૂલ, સરદારનગર, ભાવનગર

સાચા



### કાગડાની નિયમિતતા

મારા મકાનના ધાબા ઉપર પંખીઓ માટે પાણીનું વાસણ મૂક્યું છે. ઉનાળાના ધોમધખતા તાપમાં પંખીને પાણી મળે તે હેતુથી હું દરરોજ સાંજે છ વાગ્યે તેમાં ઠું પાણી રેતું છું. આજુબાજુ પણ થોડું પાણી રેતું છું. આમ નાનકદું તળાવ જેવું બની જાય છે. બે મહિનાથી આ સીલસિલો ચાલતો હોવાથી નિયમિત

આવતા કાગડા જો એકાદ દિવસ પણ મોટું થઈ જાય તો કા-કા-કા કરી હોલાહલ કરી મૂકે છે. આ કેવી નિયમિતતા!

બંસીવાવ શાહ  
૧૨, તાસત સો., મુદ્રાપુરા પાસે, અમદાવાદ-૧૫

સાચા



### કચુભમાં શકરાના માળા

કચુભમાં શકરાના માળા ઘણા દેખાય છે. કચુભમાં શકરાને ‘સીચોણું’ કહે છે. મારા અવલોકન પ્રમાણે શકરાની માદાની આંખો પીળી હોય છે, જ્યારે નરની આંખો લાલ હોય છે. આ વાત સારી છે કે પછી મારો દણીભમ છે? (કોઈ પુસ્તકમાં એવો ઉલ્લેખ નથી-સં.)

કવિ તેજ

નાલિયા, કચુભ

સાચા



### ખીજડિયામાં જળહળનું પુનઃદર્શન

ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા જામનગરથી ૧૨ કિ.મી. દૂર ‘ખીજડિયા પક્ષી અભયારણી’ છે, જેનો જૈવિક વિવિધતા (Biodiversity) ઉપર બૃહદ અભ્યાસ હાથ ધરાયેલ છે. એમાં ઓગાં, ૨૦૦૧થી શિયાળું પક્ષીઓ માટે, માસમાં એક વખત પક્ષીનિરીક્ષણ કરવાની તક મળી.

જંબુડાવાળા ભાગમાં સપેન્સબર માસમાં ૭૮ જળહળ (Indian Skimmer) નોંધાં. જ્યારે ડિસેન્બર માસમાં ‘સૌરાષ્ટ્ર કેમીકલ્સ’ના ખીજડિયા સોલ્ટ પેનમાં (RA-૩ પ્લોટની બાજુમાં) ૧૮૪ જેટલાં જળહળ આરામ (resting) કરતા નોંધવામાં આવ્યા. તેને ઘણી જ નજીકથી લગભગ અડખો કલાક સુધી નિહાળવાનો આનંદ મળ્યો. એવામાં અચાનક કોઈ

ખલેલ પહોંચવાથી તે પક્ષીઓ એકી સાથે ઉડીને દરિયાઈ વિસ્તાર બાજુ જતાં જોવા મળ્યાં. તો શું, આ પક્ષીઓ જ્યારે ખીજાયામાં જોવા નથી મળતા ત્યારે દરિયાઈ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં આવાસ કરતાં હશે?

### જ્યામકાશ પટેલ

જી-૭ અકાશ ફ્લેટ, ગુલાબ ટાવર રોડ, થલતેજ, અમદાવાદ.



### પ્રવાસી પક્ષીઓ મોડાં કેમ?

મારા આ વખતના ટીબી સિંચાઈ તળાવના પક્ષીનિરીક્ષણમાં મેં નોંધ્યું છે કે, આ વર્ષ શિયાળું યાયાવર પક્ષીઓ અહીં મોડા આવ્યાં છે. ગયા વર્ષ સૌ પ્રથમ ઓગષ્ઠ મહિનામાં કાદવ ખૂંદનારા (Waders) અને થોડી બતકો (Ducks) આવી હતી, પરંતુ આ વખતે સૌ પ્રથમ અહીં ટીલિયા (Ruff and

Reeve), તથા કાળીપૂંછ ગડેરાં (Blacktailed Godwit), પ્રથમ ઓક્ટોબર મહિનામાં આવ્યાં છે, બીજાં કોઈ પક્ષીઓ હતાં નહિ. મોડા આવવાનું શું કારણ હોઈ શકે? પાણીનો ભરાવો સારો છે, તથા આસપાસનાં બીજાં તળાવો પણ ભરેલાં છે.

તા. ૧૮-૮-૦૧ના ૨૦૪ જાંબુધોડા

અભયારાણુયમાં પક્ષીનિરીક્ષણ દરમિયાન ડોન બોસ્કો સ્કૂલ પાસે મલબાર વિસ્તારમાં એક નારંગી કસ્તૂરો (Orangeheaded Ground Thrush) જોયો. ‘ઓર્નિસ્ક્રીપ’ના પુસ્તકમાં આ પક્ષીનો વ્યાપ આ વિસ્તારમાં દર્શાવાયેલો નથી.

વિરેન્સ્ટ્રિલ આલા

એ-૨૫, કલ્યાણનગર, વાધોદિયા રોડ, વડોદરા.



## સારકુલ વોચ

❖ તા. ૧૦-૩-૦૨ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાંપોદર ગામની સીમમાં ચાર સારસ જોયા. તેમાં બે પુખ્ત અને બે બચ્ચાં હતાં. છેલ્લાં સાત વર્ષથી સારસ, અહીં માળો કરી બચ્ચાં ઉહેરે છે.

❖ તા. ૮-૬-૦૨ ના રોજ સુરેન્દ્રનગરથી સાસણગીર જતાં રસ્તામાં ધોળાધજા તેમ પાસે એક સારસ બેલડી જોઈ હતી. મારી સાથે મિત્રો, ચીકુ વોરા તથા ફારુક ચૌહાણ હતા.

❖ તા. ૨૭-૬-૦૨ ના રોજ ચીકુ વોરા, દેવાંગ શાહ તથા ફારુક ચૌહાણ સાથે મેમકા રોડ ઉપર એક ખેતરમાં સારસની જોડી જોઈ હતી.

❖ ૧૬ તથા ૧૭-૭-૦૨ ના રોજ મેમકા રોડ ઉપર સારસની એક જોડી જોઈ. આ જોડી છેલ્લાં ૪ વર્ષોથી આ જ જગ્યા ઉપર માળો કરે છે. આ વર્ષ માળાની શરૂઆત નાની

તલાવીમાં બાવળના કાંટ વચ્ચે થઈ હતી. ૨૩-૭-૦૨ના રોજ પ્રથમ વખત ઈડાં જોયાં. પછી અવાર-નવાર નર અને માદાને વારાફરતી ઈડાં સેવતાં જોયા. તેમાં નર ઈડાં સેવનમાં વધારે સમય ફાળવતો હોય તેમ લાગ્યું. આ જોડીએ પ્રથમ વખત આટલા મોડા ઈડાં મૂક્યા છે. ૬૨ વખતે લગભગ જૂનના પ્રથમ બે સમાઈ દરમિયાન ઈડાં મૂકી દે છે. છેલ્લાં ૪ વર્ષમાં સાત બચ્ચાંને મોટાં થેવાં નોંધાયા છે.

❖ તા. ૨૩ તથા ૨૬-૭-૦૨ ના રોજ માળોદના રસ્તા ઉપર (કયો તાલુકો? - સં.) સારસની જોડી જોઈ. માળો બનાવ્યાની કોઈ જગ્યા દેખાઈ નથી.

યોગેન્દ્ર શાહ

‘આનંદ’, અણતનાથ સોસાયટી પાસે, અનતાન રોડ, સુરેન્દ્રનગર

❖ તા. ૮-૬-૦૨ ના રોજ ભુખી તેમ (તા. નાયત્રાણા) પર ત્રણ સારસ જોયા.

### શાંતિલાલ વડુ

જૂના વાસ, મંદિરવાળો ખાચો, માધાપર, ભુજ-૩૭૦૦૨૦



❖ દાહોદમાં છાબ તળાવમાં બે જોડી તથા આસપાસના નઘરાળા તથા એક અન્ય તળાવમાં પણ સારસની એક-એક જોડી નિયમિત જોવા મળે છે. (૧૮-૭-૦૨નો પત્ર)

### શાકીર કરીવાલા

દાહોદ



❖ આ વખતે (૨૦૦૨) સૌરાષ્ટ્રમાં પ્રથમ વરસાએ મોટા ભાગનાં જળાશયો ભરી દીધાં છે. જે તળાવો કે જળાશયોના કંઠે ચીયા કે ડીલો વનસ્પતિ છે તેવાં જ જળાશયોમાં સારસ જોવા મળ્યાં, જેવાં કે, માલાકા, સરલા, સુમનગઢ, થાન પાસેની તલાવડી, ભીમસર વગેરે. તેમ વિસ્તારો કે જ્યાં

ઉપરોક્ત વનસ્પતિ નથી, ત્યાં સારસ જોવા મળ્યાં નથી, દા.ત. નાયકા તેમ, થોરીયાળી, સુખભાદર, સલુંઠી વગેરે. આસપાસની નવી ખેત-તલાવડીઓ જ્યાં આ વનસ્પતિ નથી ત્યાં પડ્યા આ પક્ષીઓ જોવા મળ્યાં નથી.

સારસ પક્ષીનાં આવાસ માટે જ્યાં પાણી ભરાય છે ત્યાં ધાસ, નાળો, ડીલો જેવી વનસ્પતિની ઉપસ્થિતિ પણ આવશ્યક છે, તેમ આ અવલોકન ઉપરથી જરૂરાય છે.

### કિશોરચંદ્ર રાવળ

જૂના બસ સ્ટેન્ડ પાસે, બ્રાલાણ લોજનશાળાની બાજુમાં, મુણી-૩૬૩૫૧૦



❖ તા. ૮-૬-૦૨ ના રોજ હાથેજ ગામથી થોડે દૂર ખેતરોમાં પાણીની આસપાસ સારસની એક જોડ જોવા મળી. આસપાસ બકરીઓ ચરતી હતી જેનાથી તે વિશેષ પામતા ન હતાં.

### શોઅબ વોરા

૬, મદની પાઈ સોસાયટી, મરીદા રોડ, નડિયાદ



## ગીધ પર જાપતો

### \* સુરેન્દ્રનગર આસપાસ ગીધ અવલોકન

❖ “બાકરથળીમાં છેલ્લા વર્ષથી મોટી સંઘામાં ગીધ મૃત્યુ પામી રહ્યા છે”, તે અહેવાલ આ અગાઉ બે વાર ‘વિહંગ’માં આવી ગયો છે. થોડા દિવસ અગાઉ, બાકરથળીના નિવાસી એક વ્યક્તિએ તાજેતરમાં જ મૃત્યુ પામેલા એક ગીધનો ઉલ્લેખ કર્યો હતો. આમ ગીધના મૃત્યુનો સીલસિલો હજુ ચાલુ જ છે, એમ કહી શકાય. (૨૧-૩-૦૨ નો પત્ર)

❖ વઢવાણ પાસે ચ્યારાના વાડા પાસે તા. ૧૮-૩-૦૨ ના રોજ ૬૮ ગીધ, ૧ ખેરો (Scavenger Vulture) તથા ૮ સમરી (Pariah Kite) જોઈ હતું.

❖ તા. ૧૭-૧-૦૨ ના રોજ બપોરે ૧૨-૪૪ વાગ્યે મારા ભિત્ર ઈન્દ્રસિંહ જાલાનો ફોન આવ્યો કે, તેમની સોસાયટી સંસ્કારના પાછલા ભાગે પાળી ઉપર એક ગીધ બેંદુ છે, જે

દીરી શકતું નથી. તે જ્યારે પાંખ પહોળી કરે છે ત્યારે ડાબી પાંખમાં ઘા દેખાય છે.

તરત જ હું, ચીકુ વોરા તથા મહાવીરસિંહ પરમાર ત્યાં ગયા. ઘણી મથામજા બાદ બપોરે ૩-૦૦ વાગ્યે ગીધને પકડી શક્યા. ઘરે લાવી, તેની પાંખના ઘામાંથી દોરી કાઢી (આશરે ૨ કૂટ લાંબી) અને ઘા સાફ કરી વઠવાણ પાંજરાપોળના પાછળના સુરક્ષિત ભાગમાં તેને મૂકી આવ્યા. તા. ૨૦-૧-૦૨ના રોજ ગીધ ત્યાંથી દીરી ગયું, તેવા સમાચાર ત્યાંના પગીએ આપ્યા. આ અગાઉના વર્ષે પડ્યું દોરીથી ઘાયલ થયેલું એક ગીધ, ઉત્તરાયજના દિવસોમાં મળ્યું હતું.

❖ તા. ૨૫-૩-૦૨ ના રોજ હું અને મહાવીર સિંહ, વઢવાણ જતા હતા ત્યારે ૮ ગીધ ઉડતાં જોયાં.



શાકીર

## ગોધ પર જાપતો

- ❖ તા. ૫-૪-૦૨ ના રોજ જાંબુ ગામ પાસે ૧૪ ગીધ જામનગરમાં ૨૬-૩-૦૨ ના રોજ સાત રસ્તા પાસે ગીધ ઉડતાં અને તુ ગીધ જમીન પર બેઠેલાં જોયાં.
- ❖ તા. ૨-૬-૦૨ ના રોજ પ્રાંગધ્રાથી હળવદના રસ્તા ઉપર લગભગ ૩૦ ગીધ ઉડતાં અને ૭ ગીધ બેઠેલાં જોવા મળ્યાં.
- ❖ પ્રાંગધ્રા, લશકરી વિસ્તારના ઊંચા પીપળનાં તથા લીમડાનાં વૃક્ષો ઉપર રસ્તા ઉપરથી જ ગીધના ૧૩ માળા નોંધાં છે. ૬ માળામાં ગીધને બેઠેલાં જોયાં છે (તા. ૨-૬-૦૨). આ વિસ્તારમાં અંદાજે ૧૫૦ થી ૧૮૦ ગીધ છે.
- ❖ તા. ૨૮-૫-૦૨ના રોજ બાકરથળી ગામથી આવેલા અમારા મિત્ર રણજિતસિંહ જાલાએ જાણાયું કે, છેલ્લા મહિનામાં ૭ ગીધ જાડ ઉપરથી મર્યાદ છે. મૃત્યુનું કારણ પહેલા મુજબનું જ છે. ઢીચણમાં સોજે આવી જવો, ઢીચણમાંથી પાણી નીકળવું, માથું નીચે નાખીને જાડ ઉપર બેસી રહેતું અને પછી જાડ ઉપરથી નીચે પરીને ગ્રસ-ચાર દિવસમાં મૃત્યુ પામવું. આ મરતાં ગીધોને બચાવવાના કાંઈક કરવું જોઈએ.
- ❖ તા. ૨૧-૭-૦૨ના રોજ વઢવાણ પાસે ગીધના બે માળા જોયા. આસપાસ ૪ ગીધ જોવા મળે છે. આ જ દિવસે વઢવાણ ભામના ઈજારા પાસે ૩૪ ગીધ, ૬ સમડી તથા ૧ ખેરો (Scavenger Vulture) જોવા મળ્યાં.

યોગેન્દ્ર શાહ

'આનંદ', અજીતનાથ સોસાયરી પાસે, જીનતાન રોડ, સુરેન્દ્રનગર

❖ તા. ૨૫-૫-૦૨ના રોજ નલિયા (કચ્છ) પાસે વીજાણે ગામ આગળ ૧૭ તથા જખૌ આગળ ૮ ગીધ જોયા. ગીધના બે માળાની પણ નોંધ કરી.

❖ તા. ૧૦-૩-૦૨ ના રોજ નલિયા ગામ પાસે ૫ ગીધ જોયા.

શાંતિલાલ પટેલ

જૂના વાસ, મંદિરવાળો ખાંચો, માધાપર, જુજુ-૩૭૦૦૨૦

❖ ૨૫-૩-૦૨ ના રોજ રાજુલા પાસે એક ગીધ જોયું.

જૂના વખતમાં દોર મરી જતાં તેમને ખુલ્લામાં મૂકી દેવામાં આવતાં. હમણાં ઘણા સમયથી ક્યાંતો તેમને મીઠું નાખીને દાટી દેવામાં આવે છે અથવા ચામ્ચું ઉતારીને પણ દાટી દેવામાં આવે છે. આને કારણે ગીધને ખોરાક પૂરતો નહીં મળતો હોય? આ બાબતે બધા પક્ષી-પ્રેમીઓ પોતાના વિસ્તારમાં તપાસ કરે તો કેમ?

❖ તા. ૧૩-૭-૦૨ના રોજ રાજુલા પાસે નદીમાં ૧૦ ગીધ જોયા.

ડૉ. પી. પી. મુછદિયા

નવા ગાયની મંદિર સામે, રાજુલા, જિ. અમરેલી-૩૬૫૫૪૦

❖ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસોમાં મારા ગામ મૂળીથી ૩૦ કિ.મી. દૂર થાન ગામે જવાનું થયું. ત્યાં ગામની વચ્ચે નાનું તળાવ છે. ત્યાં વાસુકિદાદાનું મંદિર છે. અહીં બાથ ભરતાં બે હાથમાં ન સમાય તેવાં આંબલીનાં વૃક્ષો છે. એક રાયણનું વૃક્ષ પણ છે. પીપળા પણ છે. તળાવને ફરતાં, આ વૃક્ષો પર ગીધના સાત માળા જોયા અને ગીધની કુલ સંખ્યા ૭૦ જેટલી હતી.

તરણતેરના રસ્તા પર એક મોટું તળાવ આવેલું છે. ત્યાં પણ વૃક્ષો છે. ત્યાં ૨૦ ગીધ જોવા મળ્યાં.

કિશોરચંદ્ર રાવળ

જૂના બસસ્ટેન્ડ પાસે, ભાગણ લોજનશાળાની બાજુમાં,

મૂળી ૩૬૩૫૧૦

❖ નાદિયાદ શહેરના 'પિલન્ડ્રી' વિસ્તારમાં ગામાં શહેરની ગંદકી દાલવામાં આવે છે. મરેલાં જાનંદરો પણ ત્યાં નાખવામાં આવે છે. અહીં ૩૦-૩૫ ગીધ કાયમ જોવા મળે છે. ક્યારેક તો તે આથી પણ મોટી સંખ્યામાં હોય છે.

શોઅબ વોરા

૬, મદનાનાર સોસાયરી, મરીડા રોડ, નાદિયાદ-૩૮૭૦૦૨

❖ તા. ૧૩-૮-૨૦૦૧ના રોજ સવારે ૭-૩૦ વાગ્યે વેકરિયાથી નગરસરોવર પગપાળા જતો હતો ત્યારે, ગામને પાદરે ૧૨ ગીધ આકાશમાં ઉડતાં જોયાં. બપોરે ૧૨ વાગ્યે પાછો આવ્યો ત્યારે ૨૨૫ થી વધારે સંખ્યામાં ગીધ, એક મરેલી ભેંસને ફરતાં જોવા મળ્યાં. તેમાંનાં મોટા ભાગનાં સફેદપાઈ ગીધ (Whitebaked Vulture) હતાં. કેટલાંક જિરનારી ગીધ (Longbilled Vulture) છોય તેવું લાગ્યું.

કાસમ સમા

વેકરિયા, નગરસરોવર



#### ❖ Vulture nesting in IIM Campus

I have noticed a nest of Whitebacked Vultures on the IIM campus. There is a colony of about 15 Vultures also roosting on the same tree.

There used to be a large number of these Vultures in this campus till about 2-3 years ago, but they seemed to have disappeared. I believe, their disappearance is a widespread phenomenon, more or less nationwide. Their recent reappearance is a good sign and therefore I thought you might like to know about this.

I had put this information on one of the electronic networks and have been informed by a friend in Delhi that these Vultures have also been noticed in Delhi again.

**Jagdeep Chhokar**

405, IIM Campus, Vastrapur, Ahmedabad 380015



❖ તા. ૧૫-૫-૦૨ના રોજ નાના પાડા (વધઈથી ૪૦ ક્ર.મી. સાપૂતરા તરફ) ગામ પાસે, આકાશમાં દ થી ૭ ગીધ ચકરાવા લેતાં જોયાં.

સનમ પટેલ

૫૪, નિલકંઠ નગર, પેટ્રોલ પંચ સામે, ભટાર રોડ, સુરત



❖ કચ્છમાં ગીધનું પ્રમાણ ઠીક ઠીક છે. તેરામાં પાંજરાપોળ પાસે ગઢરાંગી ઉપર મેં ૬૦ ગીધ તા. ૨૫-૩-૦૨ના રોજ ગણ્યા હતા. જો કે, તેરાની બાજુમાં ૧૫ ક્ર.મી. પર આવેલા બાલાપર બુડ્ઝો ગામે ને દિવસ પહેલા ગાય મરી ગયેલી હતી ત્યારે તેના ઉપર એક પણ ગીધ જોવા મળ્યું ન હતું. કાગડા બેઠેલા હતા.

નિલિયા બાજુ જતાં ગીધના ઘણા માળા દેખાય છે જેમાં એક એક બચ્ચું પણ બેઠેલું દેખાય છે. (માળાની સંખ્યા, વૃક્ષના પ્રકાર વગેરે વિગતો ઉપયોગી થાય - સ.)

કવિ તેજ

નિલિયા, કચ્છ



❖ આ વખતે પક્ષીનિરીક્ષણ માટે હું મારા મિત્ર બિરેન કક્કર, ગીર અને આસપાસનાં વિસ્તારમાં ફરી રહ્યા હતા. તા. ૧૧-૧૨-૨૦૦૧નાં રોજ બપોરે ૧૨-૩૦ કલાકે આંબાકૂઈ તેમ પાસે (દેવગામ) આકાશમાં ત્રણ ખેરા જોયા જેમાં બે અપુખ્ત અને એક પુખ્ત હતું. આ ઉપરાંત, તે જ દિવસે ૧૦-૩૦કલાકે કાઢી અને અમરાપુર ગામ (તાલુકો જુનાગઢ) જવાના રસ્તે લોલિયા નદીની પાછળા, આકાશમાં એક સફેદપાઈ ગીધ જોયું.

દોઢ વર્ષ પહેલાં સાસ્ટેભર મહિનામાં હું જ્યારે વિરમગામથી ૨૦ ક્ર.મી., માંડલ ગામ ગયો હતો ત્યારે ગામનાં બસ-સ્ટેન્ડ પાસે એક મોટા આંબલીના જાડ ઉપર સાંજે આશરે ૨૫-૩૦ જેટલાં સફેદપીઠ ગીધ જોયા હતાં, જે ત્યાં રોજ રાત્રિવિસામા માટે આવે છે, એમ જાણવા મળ્યું. આજુબાજુનાં બીજા બે - ત્રણ મોટાં જાડ પર પણ ગીધ હતાં. બધાં મળીને કુલ પચાસેક ગીધ હશે. આ એક માહિતી આપવાના હેતુથી લખી રહ્યો છું, જેથી નજીક રહેતાં પક્ષીનિરીક્ષકો અહીની મુલાકાત લઈ શકે.

ગાલા વિરેન્દ્રસિંહ એમ.

ઓ-૨૫, કલ્યાણનગર, વાધોડિયા રોડ, વડોદરા



## પત-કોટુ


ક હિંગોળગઢમાં બપૈયો હમેશથી છે

‘વિહંગ’ના ૧૩માં અંકમાં શ્રી લવકુમાર સાહેબે ‘વિહંગવલોકન’ માં હિંગોળગઢમાં બપૈયો (Hawk Cuckoo) પહેલાના સમયમાં ક્યારેય સાંભળવા મળતો નહીં, એમ જ્ઞાવેલું છે. એ અનુસંધાને, ઓગષ્ટ-૧૯૮૧માં હિંગોળગઢ ખાતે હું પ્રકૃતિશિક્ષણ શિબિરમાં ભાગ લેવા ગયો હતો. પક્ષીનિરીક્ષણ કરવાનું હજુ શીખતો હતો, ત્યારે શ્રી મોહિતભાઈ અંધારિયા, દર્શન પાઠક વગેરે સાથે મેં બપૈયો ત્યાં જોયો હતો એ મને ચોક્કસપણે યાદ છે. ત્યાર બાદ, દસ વર્ષના ગાળા પછી ૧૯૮૦ થી ૮૭ સુધીમાં ઘડી વાર હિંગોળગ ગયો હું અને ચોમાસા દરમિયાનની પ્રતેક મુલાકાત વખતે તેને જોયેલો છે અથવા સાંભળેલો છે. ‘હેન્ડબુક’ માં બપૈયો “A rains straggler in Rajasthan and semi-desert portions of Gujarat” એમ પણ જ્ઞાવેલ છે, એ લક્ષમાં લેલું જરૂરી જ્ઞાય છે. સ્ટ. ધર્મકુમારસિંહજીએ ‘બર્ઝ્ઝ ઓફ સૌરાષ્ટ્ર’માં, બપૈયો ગીરનાં ફંગલોમાં કદાચ આંખું વર્ષ જોવા મળી શકવાની શક્યતા જ્ઞાવેલ છે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં થોડાં પક્ષીઓ મેં મહિનામાં અને બાકીનાં વરસાદના આગમન બાદ તુરત આવી પહોંચતાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. Grimmett- Inskip- Inskip તેની habits માં જ્ઞાવેલ છે કે.... “but more often seen because it frequents less thickly wooded country” W.W.F. દ્વારા બહાર પડાયેલ ‘એક્સિસ્ટ’ માં પણ તે હિંગોળગઢમાં નોંધાયેલ હોવાનો ઉલ્લેખ છે, જે જ્ઞાન સારું.

તા. ૨૩-૬-૨૦૦૧ના રોજ શ્રી બહુલભાઈ સાથે ખીજાયાની મુલાકાત લઈ પરત આવતા રાજકોટના ન્યારી તથા આજી-૨ ખાતે અશોકભાઈએ પીળી પાનભગલી (Yellow bittern) તથા શ્વામશિર ટપૂસિયા (Blackheaded Munia)ના માળાના સ્થળો દેખાડ્યા. અશોકભાઈએ કરેલાં નિરીક્ષણો દાદ માંગી લે છે. તેઓની જ્યાએ હું હોત તો કદાચ એટલા દુર્ગમ (?) વિસ્તારમાં કદાચ ગયો ન હોત. અશોકભાઈને “Keep it up” કહેવાની સાથે સાથે તેમના જેલું બારીકાઈબર્યું નિરીક્ષણ, માળાને કે પક્ષીને સહેલેખ ખલેલ પહોંચે નહીં એ રીતે વધુ ને વધુ મિત્રો કરી શકે તો સારું, એમ થાય છે.

વન વિભાગમાં હું એટલે જ્ઞાવું હું, એવી ટકોર કદાચ કોઈ કરે તો પણ વાંચો નહીં, પરંતુ મને એંબું લાગે છે કે, વન વિભાગમાંથી હવે પહેલા કરતા ઘણા વધુ (અલબત્ત હોવા જોઈએ તે કરતા ઘણા

ઓછા) કર્મચારીઓ-અધિકારીઓ પક્ષીનિરીક્ષણમાં રસ લેતા થયા છે. આ વર્ગ, બારીકાઈબર્યું નિરીક્ષણ કરી ‘વિહંગ’ મારફતે માહિતી આપતો થાય તો કદાચ ઘડી સારી માહિતી પક્ષીનિરીક્ષક મિત્રોને ગ્રામ થઈ શકશે, તેમ મને લાગે છે.



ઉદ્ય વોરા

૧૬૮, સ્વીટ હોમ એપાર્ટ., સેક્ટર-૨૮, ગાંધીનગર

નિરીક્ષણ

ક મેને ફરીથી પક્ષીનિરીક્ષણ ચાલુ કર્યું”

સૌથી પહેલા ‘સોરી’ કે તમને મોડો પત્ર લખું હું. શું કરું પણ, આ વખતે હું પરેશાન થઈ ગયો હું. કારણ કે, સૌથી પહેલા અમારો ઉપવાસનો મહિનો ડિસેઝરના અંત સુધી રહ્યો. ત્યાર બાદ, મોટા ભાઈના કહેવાથી આંદાં, પોલીઓના કેમ્પમાં ગયો ને ત્યાં મારું ઓપરેશન કરવામાં આવું, માટે ત્યાં ૩૦ ડિસે. થી ૧૧ જાન્યુઆરી સુધી રહ્યો. પગમાં સણિયો નાખ્યો તેમાંથી દોરીઓ વડે હીટો લટકાવીને ‘ટ્રેક્શન’ આપ્યું ને તે પછી ઘરે પણ તેલું જ, દોઢ થી બે મહિના સુધી રાખ્યું. માટે ત્યાં સુધી હું પક્ષીનિરીક્ષણ ન કરી શક્યો. ત્યાર બાદ, મને ‘કુલિપર બુટ’ પહેરાવીને ધોડીઓ આપી ચાલતાં કરી દીધો. તે માટે હું ખુશ હતો, પણ એટલામાં કોમી તોફાનો ફાટી નિકળ્યાં. જ્યાં જાઓ ત્યાં ‘કરફ્યુ’, ઘરની બહાર નિકળવાનો ‘ઓર્ડર’ નહિ. તે પણ દોઢ-બે મહિના સુધી ચાલ્યું. હવે કંઈક શાંતિ લાગે છે. બોલો આવું નસીબ છે! માટે હું છેલ્લા પાંચ - છ મહિનાથી તમને પત્ર ન લખી શક્યો. હમણાં થોડા દિવસોથી મેં પક્ષીનિરીક્ષણ શરૂ કર્યું છે.

દર વખતની જેમ ધંટી ટાંકણા (Hoopoe) ની જોડીએ ઘરના તળિયામાં માળો કરી, તેમાં બચ્ચાં ઉંઠેરી અને માળો છોડી પણ દીધો. ત્યાર પછી તેમાં બાબુણી મેના એ કબજે જમાવી દીધો છે, જે હજુ ચાલે છે. (તારીખ ?-સ)

શોઅંબ વોરા

૬, મદનીપાર્ક સોસાયટી, મરીઢા રોડ, નાનીયાદ-૩૮૭૦૦૧

નિરીક્ષણ

## કુછી અને બરડાસાગરને રક્ષિત-વિસ્તાર જાહેર કરવા જોઈએ ?

અમારી સંસ્થા પ્રકૃતિ-જતન માટે અને પર્યાવરણ તથા વન્ય જીવોના સરક્ષણ માટે કાર્યરત બીનસરકારી સંસ્થા છે.

ઉપરોક્ત વિષયે સચિન્ય જાળવવાનું કે, વાતાવરણ, ખોરાકમાપિન અને રહેઠાજી તેમજ પ્રજનનની અનુકૂળતાના કારણે પોરબંદર જીવાના ધ્યાન બધા વિસ્તારો પક્ષીઓને ખૂબ જ પસંદ પડે છે અને તેથી સ્થાનિક તેમજ પરદેશી મુલાકાતી પક્ષીઓ આ વિસ્તારોમાં ખૂબ જ મોટા પાયે આવે છે. સ્વાસ્થ્ય, પર્યાવરણ અને પ્રકૃતિક રીતે અનિવાર્ય ખોરાકની સાંકળમાં પક્ષીઓ જરૂરી મહત્વની કરી છે. પક્ષીઓનું આ મહત્વ સ્વીકારીને પોરબંદર શહેરમધ્યે સરકારશીએ અભયારણ્ય જાહેર કરેલું છે.

આ અભયારણ્ય ઉપરાંત પોરબંદર વિસ્તારમાં પર્યાવરણીય રીતે ખૂબ જ મહત્વનાં જળપાણિવિત ક્ષેત્રો અને અતિ અગત્યના પક્ષીવિસ્તાર ગણી શક્ય તેવા કુછી જળસંગ્રહ અને બરડાસાગર તેમ આવેલા છે. આ વિસ્તારોને અભયારણ્ય કે આરક્ષિત વિસ્તાર જાહેર કરાયેલ નથી. દર શિયાળામાં અહીં ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ કરકરા (Demoiselle Crane) તથા ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ કુંજ (Common Crane) અને હજારોની સંખ્યામાં બતકો, પેણ, હંજ, ઢોક વિગેરે પક્ષીઓ મુલાકાત લે છે. ધ્યાં બધાં સ્થાનિક નિવાસી પક્ષીઓ અહીં કાયમ માટે વસાવટ કરે છે. આ બને સ્થાનોનું પર્યાવરણની દૃષ્ટિઓ મહત્વ ધ્યાન લઈને વન અને પર્યાવરણ ખાતા દ્વારા તેમને અભયારણ્ય અથવા મહત્વનાં જળપાણિવિત ક્ષેત્રો અને અગત્યના પક્ષીવિસ્તાર જાહેર કરવા વિનંતી છે. આ વિસ્તાર પક્ષીઅભ્યાસીઓ માટે ફરવાનું અને વિહરવાનું સ્થળ બને તેમ છે અને તેથી આ વિસ્તારના નાના ધ્યાધીઓને પણ સારો ફાયદો થાય તેમ છે. ‘ટુરીસ્ટ પોઈન્ટ’ તરીકે વિક્સી શકે તેવું સુંદર સ્થળ બની શકે તેમ છે. આજુબાજુના વિસ્તારમાં રહેતાં લોકો પણ આ વિસ્તાર સાથે જોડાયેલા હોઈ પક્ષીઓના રક્ષણ માટે ચિંતિત રહે છે. અહીં કુંજના શિકારીઓને સ્થાનિક લોકો સાથે સંઘર્ષ થયાના બનાવો પણ બનતા રહે છે. મહત્વનાં જળપાણિવિત ક્ષેત્રો અને અગત્યના પક્ષીવિસ્તાર તરીકે અધિકૃત રીતે જાહેર થયેથી સંબંધિત વિસ્તાર જેની હક્કુમતમાં આવે છે

તે જંગલખાતા અને પોલીસખાતા દ્વારા આ વિસ્તારના પક્ષીઓ અને પર્યાવરણના સંરક્ષણને મહત્વ આપવામાં આવશે. આ બને અગત્યના પક્ષીવિસ્તારોમાં અભ્યાસ, પક્ષીગણતરી વિગેરે હાથ ધરી માહિતીસંપુટ (database) એકત્ર કરી શકાય. આ વિસ્તારોને અને ત્યાં આવતાં પક્ષીઓને કોઈ જોખમ હોય તો તે શોધી કાઢી ભવિષ્યમાં તેના રક્ષણ માટે જરૂરી પગલાં લેવાની યોજના સરકારી ધોરણે ધરી શકાય.

## સરકારશીને અપીલ

ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉધાનો, રક્ષિત જંગલો વિગેરે ખાતે દર વર્ષ પ્રકૃતિ તથા પર્યાવરણીય શિબિરોનું આપોજન થાય છે. આવી શિબિરોમાં મહદું અંશે બાણકો, વિધાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ભાગ લેતાં હોય છે. આવી શિબિરોના કારણે શિબિરાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત પત્યે જાગૃત કેળવાય છે.

આપણે સૌ જાડીઓ હીએ કે, સરકારશીની પર્યાવરણ સંરક્ષણની નીતિઓ અને યોજનાઓનો જેના મારફત અમલ કરાવવાનો છે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં વન વિભાગના અધિકારીઓ જે કાર્યવાહીઓ કરે છે તેને જેના મારફત માન્યતા અપાવવાની છે, તેવા સરકારશીના વૃક્ષછેદનના ધારા અંતર્ગત ભાભલતદારશીઓને વિશાળ સત્તાઓ મળેલ છે. જો તેઓ પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત અને વાસ્તવિકતા ધ્યાને લઈને પોતાની આ સત્તાઓ વાપરે તો ધ્યાં વૃક્ષો કપાતાં બચી શકે અને ધ્યાં ગેરકાયદેસર વૃક્ષછેદન કરનારાઓ સામે પગલાં ભરી શકાય. વિભાગના કર્મચારીઓ દ્વારા પર્યાવરણલક્ષી કાયદાઓ અનુસંધાને જે કેસો કરવામાં આવે છે, તે અનુસંધાને સરકારી વકીલશીઓ અને ન્યાયાધિકારીઓ પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત પત્યે જાગૃત હોય તો અસરકારક પરિણામ આવી શકે છે.

આ સંદર્ભે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે જેને નીતિ વિષયક નિર્જયો (પોલીસ રીસીશન) લેવાના છે, જેને પર્યાવરણ સંરક્ષણની સરકારશી તથા વનવિભાગની નીતિઓ અને યોજનાઓ ને માન્યતાઓ આપવાની છે અને અમલ કરવાનો છે અને જે પર્યાવરણ વિરુદ્ધનાં ગુન્હાઓ અને જોખમો અટકાવવા અને આવા ગુન્હાઓ કરનાર તથા જોખમો ઊભા

કરનારની નશ્યત કરવા અધિકારો ધરાવે છે તેવા સરકારશીના અધિકારીઓ વન વિભાગ દ્વારા પ્રાકૃતિક વાતાવરણમાં યોજાતી શિબિરોમાં ભાગ લેતા થાય, પ્રકૃતિ અને પર્યાવરણથી તથા તેના ઉપરનાં જોખમોથી રૂબરૂ થાય, વન વિભાગનાં કર્મચારીઓનો સંપર્ક કરી વાતાવરણકાથી વાકેફ થાય, ટૂંકમાં પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત સાચા અર્થમાં સમજતા થાય અને પ્રકૃતિપ્રેમી બને તો સાચા અર્થમાં પર્યાવરણ સંરક્ષણને અસરકારક પરિણામ આવે, તેવું અમારું માનવું છે.

તેથી ગુજરાત વનવિભાગ દ્વારા અભ્યારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, જગલોમાં પ્રાકૃતિક વાતાવરણમાં જે પ્રકૃતિ શિબિરો યોજાય છે તેમાં નિયમિત રીતે એક અથવા બે બેચમાં સરકારી અધિકારીઓશીઓ, પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ હોય તેવા પોલીસ અધિકારીશીઓ, જેઠેર સેવા તથા વીજળી બોર્ડના ઈજનેરશીઓ વગેરે ભાગ લેતા થાય તે માટે સંબંધિત અધિકારીઓ જેની ડેટા આવે છે તે હાઈકોર્ટ, ગૃહખાતુ, રૈવન્યુખાતુ, વિ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરી યોજના ઘરી કાઢવા અને વહેલી તક અમલ કરવા યોગ્ય થવા આપ સાહેબ ને અમારી નામ વિનંતી છે. જે આ શક્ય બનશે તો પર્યાવરણ સંરક્ષણ કેતે વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને સરકારશીના આચ અધિકારીઓ વચ્ચે એક સંકલન સ્થપાશે અને પર્યાવરણ સંરક્ષણને અસરકારક પરિણામો શક્ય બનશે તેવી અપને ખાતી છે. તો યોગ્ય થવા વિનંતી.

**લાંબાવદ્ધી મારી બદલી ભાવનગર જિલ્લાના મહુવા ગામે થયેલી છે.** ૧૦ જૂન થી હોહો સંભાળેલો છે. ‘વિહંગ’ના તમામ જુના અંગી જોઈ લીધા અને પૂછપરછ કરી પણ અહી મહુવા ખાતે સક્રિય રીતે અને નિયમિત પક્ષીનિરીક્ષણ કરતા પક્ષીપ્રેમીઓ હોય તેવું માલુમ પડતું નથી. મહુવા દરિયાડિનારાનું ગામ છે. બગીચાઓ - વારીઓ ખૂબ જ સારાં છે. ફળજાડ નાળિયેરીઓ વ્યાપક પ્રમાણમાં છે, તેથી પક્ષીઓનું વૈવિધ્ય હશે જ. અહી મહુવા ખાતે કોઈ પક્ષીપ્રેમીઓ હોય તેવું આપના ધ્યાન ઉપર હોય તો તે જણાવશો. દક્ષિણ ભારતના શ્રી વિજય કવેલે દ્વારા પક્ષીઓ અંગેની ખૂબ જ સારી ‘વેબસાઈટ’ તૈયાર કરાએલી છે. આ ‘સાઈટ’માં

પક્ષીઓની તસવીરો ખૂબ જ સારી છે. માહિતી ખૂબ જ સારી છે. અને પક્ષીઓને ઓળખવા માટેના ગ્રયન્ટો પણ ખૂબ જ પ્રશંસનીય છે. ‘ઈન્ટરનેટ’ ધરાવતા ‘વિહંગ’ના વાચકોને આ ‘સાઈટ’ જોવા સૂચવું છું. આ ‘સાઈટ’ નીચે મુજબ છે. [www.indiabirds.com](http://www.indiabirds.com)

### જ્યદેવ ધાર્યા

૬૨, જવાહર સો., કોલેજ રોડ, મહુવા ત૭૬૪૨૮૦

### કચ્છમાં મસ્કતી લટોરાની હાજરી

ગ્રીઝ ૨૦૦૨ના ‘વિહંગ’ના અંકમાં મારા સ્ટોલિક્ઝકાના પિદા વિશેના લેખમાં તેના શાસ્ત્રીય (લેટીન) નામની છાપવામાં ભૂલ થઈ હોય તેમ જણાય છે. *Saxicola insignis* ને બદલે ખરી રીતે *macrohyncha* હોવું જોઈએ. એ લેખના અંતમાં મેં જણાવું છે તે મુજબ, હવે મસ્કતી લટોરાના કચ્છમાં આગમનની વિગત નીચે પ્રમાણે છે.

Gre' Hypocolius અથવા Shrike Bulbul (મસ્કતી લટોરો, *Hypocolius ampelinus*) એક સમયે આપણા દેશમાં અતિ વિરલ પક્ષી તરીકે નોંધાવું હતું. (‘લટોરો’ નામ નર જાતિ સૂચક લાગે છે તો ‘નોંધાપો’ હતો લખવું જોઈએ અને તેમ હોય તો તેની નારી જાતિ ને કેમ સંબોધવું? પંખીઓના ગુજરાતી નામોથી હું વાકેફ નથી, તેથી અમુક નામો મારા માટે વિટબણા રૂપ થઈ પડે છે!) પ્રથમ વાર તે બલુચિસ્તાન-અફઘાનિસ્તાન સીમા તરફ ૧૮૮૩ સદીમાં નોંધાવું હતું. તેનો ઉલ્લેખ અંગેજ પક્ષીવિદી બ્લેનફર્ડ અને જ્યુકે કરેલ છે. ત્યાર બાદના લાંબા સમયગાળામાં સિંધમાં પણ જોવા મળેલ. સલીમઅલી અને રિપ્લી (Handbook of the Birds of India and Pakistan - Vol-5) ના અભિપ્રાય મુજબ તેને વિરલ, ભટકતા (rare vagrant) ની સંશો આપેલ. વીસમી સદીમાં હો. સલીમ અલીએ, મસ્કતી લટોરાનો એક નમૂનો ડિહિમ (માલારાઝ્ય)માં મેળવેલ હતો.

કચ્છમાં આ પક્ષીની હાજરી ૧૯૬૦માં મોટાં રણની કાંધીએ આવેલ કુલારબેટમાં માર્ય અહિનામાં નોંધાયેલી. તે સમયે ‘બોંબે નેચરલ ઇસ્ટરી સોસાયટી’એ પાયાવર પક્ષીઓના અભ્યાસ માટેની યોજના અનુસાર પક્ષીઓને

જાળીમાં પકડી તેમની નોંધ કરવા અને તેમના પગમાં કડીઓ પહેરાવવા માટે કુવાર બેટમાં ‘કેમ્પ’ કરેલો. ૧૯૫૮માં યાયાવર પક્ષીના આપણે ત્યાં આગમન સમયે પહેલો ‘કેમ્પ’ જુજ પાસે સાએભરમાં રાખેલો. કુવારબેટમાં ૧૯૬૦ના માર્ચ માસમાં પંખીઓની વિદ્યાળનો સમય પસંદ કરેલ. સોસાયટીના શ્રી પી. બી. રોખરે પ્રથમ એક મસ્કતી લટોરાની માદાને પકડેલી. તેને જોયા બાદ ડૉ. સલીમ અલીએ શેખરને કહ્યું કે, “હવે તેના નર પક્ષીને પકડશો તો તમને સોનાની વીઠી ભેટ આપીશા!” શેખરના સંદૂચીથે બીજી જ દિવસે નર પક્ષા જાળીમાં સપણ્યો! રોખરને વીઠી મળી કે કેમ તેની મને માહિતી નથી! આવી રીતે, કિછિમાં નોંધાયા બાદ ત્રીસ વર્ષ આ પંખીનું આપણા દેશમાં આગમન નોંધાયેલું હતું.

બીજા ગ્રાસ દાયક બાદ, ૧૯૬૦માં જ્યારે ઝતુ-પ્રવાસી પક્ષીઓના અભ્યાસ માટે છારીહેઠમાં આયોજન થયું ત્યારે, સર્વ શ્રી અસદ અભ્ર અને જુગલ કિશોર તિવારીએ મસ્કતી લટોરાને જોયા અને તે પૈકી અમુકને જાળીમાં પકડી કરીઓ પહેરાવેલ હતી. ૧૯૬૦ થી ૧૯૬૨ સુધીના ઉપરોક્ત અભ્યાસ દરમિયાન આ પક્ષી નિયમિત રીતે નોંધાયાં હતાં. ત્યાર બાદ, ૧૯૬૨ થી ૧૯૬૪ સુધી ‘સોસાયટી’ દ્વારા બે વર્ષનો ઘાસિયા જનીનનો અભ્યાસ થયો હતો તે દરમિયાન શ્રી તિવારીએ વેજાનિક તરીકે ફરજ બજાવેલી હતી. તેઓએ આ લટોરાનો અભ્યાસ ચાલુ રાખેલો, જેની વિગત ‘વિહંગ’માં અગાઉ આપવામાં આવી છે. તેનું પુનરાવર્તન કરવું અને જરૂરી નથી, પરંતુ આટલું જણાવી દઉં કે, ફુલાય પાસેની જારીમાં એક જ દિવસે તેમણે સવાસોથી ઉપરની સંખ્યામાં મસ્કતી લટોરા નોંધ્યા હતા.

હવે આપણા પાણેશી દેશ પાકિસ્તાનમાં આ લટોરા વિશે સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો અસ્થાને નથી. કારણ કે, કચ્છસહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝતુ-પ્રવાસી પંખીઓ આવે છે, તે બલુચિસ્તાન અને સિંધ વાટે તેમનું આગમન કરતાં હોય છે. ડૉ. ટી. જે. રોર્ડિસ (The Birds of Pakistan, Vol-2) જણાવે છે કે, ૧૯૮૦ના દાયકાથી આ પક્ષીઓ કરાંચી આસપાસનાં સ્થળો અને બલુચિસ્તાનમાં ઓછીવતી સંખ્યામાં નોંધાતાં રહ્યાં છે. છેલ્લાં જે પક્ષીઓ તેમણે બલુચિસ્તાનના એક જણાશાય પાસે જોયાં તે રાતવાસો (roosting) કરવાની

તૈયારી કરતી વખતે ઘણાં ઉતેજીત થઈ કલરવ કરતાં સાંભળવામાં આવેલાં અને તે નરમાદાની જોડિઓમાં નોંધાયાં હતાં. આ વિધાનથી તેઓ એ સંકેત આપવા માગતા હશે કે, મસ્કતી લટોરા, વખતે તેમના પ્રજનનની તૈયારીમાં હોવાનો સંભવ હતો. એક હડીકત હવે સ્પષ્ટ થાય છે કે, જે પંખી આપણા ઉપખંડમાં અગાઉ વિરલ ભટકતાં નોંધાયાં હતાં તે હવે નિયમિત ઝતુમવાસી સિદ્ધ થયાં છે. આ પંખીજગતની રસપ્રદ બાબતની પાછળનાં કારણો સંશોધનનો વિષય બન્યાં છે. આના માટે અરબરતાન, અભાતના દેશોથી દર્શાન અને અફધાનિસ્તાન સુધી તપાસ થાય તો તેનાં તથ્યો વડે ખરી હડીકત જાણવા મળે.

મસ્કતી લટોરાની ભાડીક આપણા આ પશ્મિમ હિન્દના વિભાગમાં મોટી ચોટીલી ઝૂબડી (Greatcrested Grebe) એક સમયે વિરલ જળચર પક્ષી તરીકે નોંધાયું હતું, પરંતુ આજે તે કચ્છ અને સૌરાષ્ટ્રનાં જણાશયોમાં સારી સંખ્યામાં જોયા મળે છે. અમુક પક્ષીઓનું આપણા આ પ્રદેશોમાં પ્રજનન પણ નોંધાયેલું છે. ઉપરોક્ત પંખીઓની જેમ આપણે ત્યાં વાધોમડી (Slenderbilled Gull) વણી થોડી સંખ્યામાં અગાઉ નોંધાયેલ હતી, જ્યારે હાલનાં વર્ષોમાં આ દરિયાઈ પક્ષી ફક્ત સામાન્ય (Common) નથી, પરંતુ અમુક વખતે તે મોટી સંખ્યામાં પોતાની હાજરી પૂરાવતાં હોય છે.

મ.કુ.હિંમતસિંહજ

જ્યુબિલી ગ્રાઉન્ડ, ભુજ-૩૯૦૦૦૧

## ૫ પક્ષીજાતિઓના વ્યાપ માટે વધુ અને સતત અભ્યાસની જરૂર

શિશિર ૨૦૦૨, ‘વિહંગ’ સંખ્યા અંક-૧૫માં શ્રી સુનીલ કે. પુવાર દ્વારા લખાયેલી નોંધ ‘પંચમદાલમાં હરિતભાલ હરેવો (Goldfronted Chloropsis)ના અનુસંધાને આ નોંધ લખવા પ્રેરાયો છું. ૧૯૮૮થી ૨૦૦૨ સુધીના સમયગાળામાં મેં રતનમદાલ, બાકોર (પંચમદાલ), જાંબુધોડા તથા ડાંગ વિસ્તારમાં સથન પક્ષીનિરીક્ષણ કરેલું છે અને તેના આધારે આ વિષયમાં

પત્ર-સ્ટોર્ટ

થોડી ચોખવટ કરવી તથા માહિતી આપવી જરૂરી છે, તેમ સમજને લખું દું.

રતનમહલ તથા ડાંગ બજે વિસ્તારોમાં મેં બજે પ્રકારના હરેવા (હરિતભાલ : Goldfronted તથા હરિતનીલ : Godmantled) જોયા છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ- રાજીવીપળા તથા ઉત્તર ગુજરાતમાં આ હોવાની શક્યતાઓ તો છે જ, પરંતુ આ પક્ષીઓ અત્યાર સુધી નહીં નોંધાવાનાં ત્રણ કરાડ્યો છે.

૧. બજે હરેવા અનુકરણમાં માટેર હોવાથી તેમની હાજરીની જ્ઞાન થતી નથી. કોશી(Black Drongo) થી માંગીને ધ્યાં પક્ષીઓના અવાજની આબેહૂબ નકલ કરવાની તેમની શક્તિને કારણે તેની હાજરી હોવાં છતાં સામાન્યત : નોંધાયેલાં નથી હોતાં.

૨. જો પક્ષીનિરીક્ષક ધ્યાનથી જુઓ અને દરેક વખતે હરેવો છે, એ ઘ્યાલ આવે ત્યારે, “બેમાંથી કયો ?” એવો સવાલ થાય, તો જ આ માહિતી મળે. ખાસ કરીને યોગ્ય પ્રકાશ ન હોય, ત્યારે આ બેમાંથી કયો તે કહેવું મુશ્કેલ થતું હોય છે, એવો મારો અનુભવ છે.

૩. ગુજરાતના ઘણાં વિસ્તારોમાં સધન પક્ષીનિરીક્ષણ (અને તે પણ લાંબા સમય માટે)નો અભાવ છે. જેમ-જેમ પક્ષીનિરીક્ષકોની સંખ્યા અને અનુભવ વધે છે, તેમ-તેમ નવી માહિતીની ઉપલબ્ધિ અને સંચય થાય છે.

ડૉ. સલીમ અલીથી માંડીને શ્રી લાલસિંહ રાઓલ

જેવા પીઠ અને અનુભવી પક્ષીનિરીક્ષકોએ પોતાનાં પુસ્તકોમાં વારંવાર તાપી કે નર્મદા નદીને જુદા-જુદા પક્ષીઓના વ્યાપ અંગેની સીમા તરીકે દર્શાવ્યા છે, જે કદાચ ઉચ્ચિત નથી. પાંખો ધરાવતા અને લાંબા અંતર સુધી ફેલાતા જીવોને માટે નદીઓ ભાગ્યે જ આડખીલી હોઈ શકે. આ અનુસંધાને કહેવું જરૂરી છે કે, જેનો વ્યાપ તાપીથી દક્ષિણે બતાવાયેલો છે, તે રતનમહલમાં અને સૂરપાણેશ્વરમાં જોવા મળે છે અને તેમાંના અમુક વિસ્તારોમાં સામાન્ય છે. વધુ

સધન અને જાગૃત પક્ષીનિરીક્ષણથી આ માહિતીમાં વખતોવખતના ફેરફારો થશે, જે નોંધીને અમુક સમયાન્તરે ‘વિહંગ’ દ્વારા એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી શકાય.

શ્રી અશોક મશરૂની નોંધ ખરેખર સુંદર છે. અવલોકન, લૈખન અને નૈતિકતા - ત્રણેયનો સરસ સમન્વય થયેલો દેખાયો. આવી નોંધો વધુ આવે તો ગુજરાતામાં ગજબનો ફેરફાર આવે. અમુક નોંધ કાઢી નાંખવા જેવી છે, અથવા તો વધુ ભેગી થાય પછી સાથે છાપવાની જરૂર લાગે છે. એક-એક લિટીની નોંધો અલગ છાપવા કરતાં એવી સમાન નોંધો ભેગી થાય પછી છાપાય તો સારું, ઉદા. અમીત શાહની નોંધ (સફેદ કાગડો) તથા ગૌરાંગ જોધીની નોંધ (પાનપણાઈની પ્રથમ અવલોકન નોંધ).

પ્રકાશ ત્રિવેદી

૧૮, સુકીમલ ફેલેટ્સ, રામદેવનગર, અમદાવાદ ૩૮૦૦૦૧૫



સાભાર રલીઝાર

૧૦૦૧-૦૦ શંકરભાઈ સોમપુરા, અમદાવાદ	૨૫૦-૦૦ ડૉ. પ્રવીણ ખત્રી, અમદાવાદ	૧૨૫-૦૦ વી. એસ. વીડાસરા, મુ. ધાવા,
૧૦૦૦-૦૦ ડૉ. રવિ બાકરે, અમદાવાદ	૨૫૦-૦૦ મિલિન્ડ મુનિ	તા. જુનાગઢ
૧૦૦૦-૦૦ ડૉ. પી. પી. મૂછદિયા, રાજુલા	૨૫૦-૦૦ અમીત ટક્કર, મહુવા	૧૦૦-૦૦ લાલદાસ વેણું, લીલા
૧૦૦૦-૦૦ બિંદુ કાપડિયા, મુંબઈ	૨૦૦-૦૦ એ.કે. દેસાઈ, ભરૂચ	૧૦૦-૦૦ એસ. એમ. પંડ્યા
૫૦૦-૦૦ દુખ્યત શુક્લ, અમદાવાદ	૨૦૦-૦૦ મહેશ, પોરબંદર	૧૦૦-૦૦ મગનભાઈ
૫૦૦-૦૦ સ્કાય ફોરેસ્ટ યુથ કલબ, કેશોદ	૨૦૦-૦૦ મુકેશ ભણ, સુરત	૫૦-૦૦ હસમુખભાઈ, અમદાવાદ
૩૦૦-૦૦ એ. એસ. પાડે, આર. એફ. એ.,	૨૦૦-૦૦ રમેશભાઈ પાટીલ, ભરૂચ	૫૦-૦૦ ડૉ. એચ. એમ. કાકર, નાનીયાદ
કેવડિયા કોલોની	૧૦૦-૦૦ વિનોદ ગજજર, અમદાવાદ	

હવે પક્ષીઓની આદતો યા ખાસિયતોનો વિચાર કરીએ તો સામાન્ય રીતે જોવામાં આવતાં પંખીઓ બારામાં આપણે માની લઈએ છીએ કે તેમની આદતોની પૂરી માહિતી ઉપલબ્ધ છે અને વિશેષ કંઈ જાણવા જેવું રહેતું નથી. તેથી તે દિશામાં આપણે ખાસ લક્ષ આપતા નથી હોતા. સામાન્ય રીતે આપણે રોજબરોજની જિંદગીમાં જોતા આવ્યા છીએ તે ચકલી(House Sparrow) આપણાં ઘરોમાં માળો બાંધે છે. પરંતુ આ પક્ષીને જાડમાં માળો બાંધતાં કેટલાં લોકોએ નોંધું હશે? જ્યાં માળા કરવાની જગ્યા ન મળે ત્યાં તે જાડ પર પણ સમૂહમાં માળા બાંધે છે! એક નવાઈ પમાડે તેવો દાખલો મેં નોંધ્યો છે. કચુમાં નખત્રાણા ગામમાં, જથ્યાં આ ચકલીને માળા માટે ઘણાં યોગ્ય સ્થળો મળી રહે તેવી સ્થિતિ છે, તે છતાં એક મોટા ખીજડાના જાડમાં તેના માળા છે.

સામાન્ય રીતે શકરા માંસાઢારી છે અને નાનાં પંખી, કાંચિંડા વગેરેનો તે શિકાર કરતા હોય છે. આ શિકારી પક્ષીને નીચે જીમીન પર ઊતરી, વરસાદ થયા બાદ જે પાંખવાળી ઉધેર જીમીનમાંથી નીકળે છે તેનો આહાર કરતાં મેં જોયું છે. બુલબુલ અને શકરખોર (Purple Sunbird) ને માખીમાર (Flycatcher) ની માફક ઊત્તીને જીવત પકડતાં મેં નોંધ્યાં છે. હજુ સુધી આ બાબતનો ઉલ્લેખ મને કોઈ પુસ્તકમાં વાંચવા મળ્યો નથી. નવાઈ પમાડે જેવી બીજી ઘટના મને તાજેતરમાં જોવા મળી. હાલ લગભગ બે મહિના પહેલાં હજુમાં વરસાદ થયો. ત્યાર બાદ, પાંખવાળી ઉધેર જીમીનમાંથી રાત્રે નીકળી હતી. તે મારા બંગલાની બાંનીથી આકર્ષિત, ચાલીની બહાર, સવારે, જીમીન પર છિવાઈ ગઈ હતી. તેને ખાવા માટે ચાર-પાંચ કબૂતર મારી નજર સમક્ષ એકત્ર થયાં અને એ જીવડાંને ખાવા માંડ્યાં. મરેલી ઉધેર ગળી જતાં હતાં અને જે જીવિત હતી તેને ચાંચ વડે આમ તેમ હલાવી આરોગી જતાં હતાં. મેં કબૂતરને દાણા ચણતા જોયાં છે. તેમને પાચનકિયામાં મદહરૂપ થવા માટે જીણી કંંકરી ગળી જતાં જોયાં છે, પરંતુ મારા ઘણા લાંબા સમયના પક્ષીનિરીક્ષણ દરમિયાન એ પંખીને જીવડાં જીતાં જોયા નથી.

કબૂતર વિશે લખતાં તેમના બારામાં એક બીજો ઉલ્લેખ કરી લઉં. આ પંખી, માનવ જાતની વસાહતો, તેની આસપાસ અને સર્વત્ર જોવા મળે છે. તેની ખાસિયતો તેની દિનચર્યા તથા તેની બચ્યાંઉછેરની પ્રવૃત્તિ આપણે જોતાં જ રહીએ છીએ. પરંતુ પંખીઓનું નિરીક્ષણ કરતા અથવા તેમનો અભ્યાસ કરતાં

કેટલાં લોકોએ તેના માળા બાંધવાની પ્રક્રિયા જોઈ હશે? કબૂતરમાં નર પક્ષી માળો કરવા માટે પાતળી અને જાડી સળીઓ શોધી, ચાંચમાં, માળાના સ્થાને લઈ જાય છે અને ત્યાં બેઠેલી માદા, તેને યોગ્ય રીતે ગોઠવવાનું કામ કરતી રહે છે. સળીઓ જોયા પછી નર, દરેક સળીને ચાંચમાં પકડી પહેલાં જાડકા મારી તેને ચકાસે છે. એ ચકાસણીમાં જે યોગ્ય ન લાગે તેવી સળીને ફંકી રે છે. આમ જે માળો બાંધવા માટે યોગ્ય હોય તેવી જ સળી લઈ જાય છે. કબૂતર વિશે આ ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે, ભલે ગમે તેટલું કોઈ પક્ષી સામાન્ય હોય પરંતુ પક્ષીવિજ્ઞાનની દર્શિએ આવી જીડ્ઝવટબરી જાણકારી મેળવવાનું કાર્ય અગત્યાનું હોય છે. પંખીઓમાં સમજશક્તિ કે મનુષ્ય-સ્વભાવ સાથે સરખાવી શકાય તેવા ભાવોનો અભ્યાસ હોય છે. જે કંઈ તેમના વલણ કે વર્તવિમાં જોવાનું મળે તે ફક્ત એક instinctive વર્તન છે જે તેમને વારસાગત મળેલું છે. હા, અમુક અનુભવથી તે શીખી શકે છે જેમ કે, એક બે વખત અમુક સમયે કોઈ ચોક્કસ જગાએ તેને ખોરાક નાખવામાં આવે તો તે સમયે અને તે જ સ્થળે તે નિયમિત રીતે પહોંચ્યો જતાં હોય છે. તેતરનો દાખલો રજૂ કરું તો, એ પંખી એક જગ્યા પર એક બે દિવસ માટે પોતાનો ખોરાક મેળવ્યા બાદ અમુક દિવસો સુધી ફરી વાર ત્યાં ખોરાક ન શોધતા સ્થળ બદલે છે. તેતરનો મુશ્ય ખોરાક ઉધેર છે અને જો એક જ સ્થળ પર તે ખોદા કરે તો એ ખોરાક ખૂદી જાય, તેથી તે ફરી વાર અમુક સમય સુધી ત્યાં જતાં નથી. આ કોઈ યોજનાબધ્ય કે સમજદારીપૂર્વકનું વર્તન નથી.

મેં અમુક સમય સુધી, પેઢીઓથી પાંજરામાં પાળેલાં અને ઉછેલાં તેતર ચાંચાં હતાં. તેમને હું સવાર - સાંજ ફરવા માટે પાંજરામાંથી બહાર કાઢતો. કોઈ ગીધ જેવાં પંખી આકાશમાં ઊચે ઊડતાં જોવામાં આવે તો એ તેતર તુરેત જીમીન પર દબાઈ બેસી જતાં અને ઉપર સતત નજર રાખતાં. કોઈ શિકારી પક્ષીનો તેમના પર હુમલો થયાનો તેમને અનુભવ થયો ન હતો, પરંતુ એ જંગલી તેતર (Wild Partridge)થી મળેલ વારસાગત વર્તન હતું. આ દાયાંતો એટલે આખ્યાં છે કે, સમજદારીપૂર્વક અને સતત, પક્ષીઓનું અથ્યયન કરીએ તો ઘડી માહિતી મેળવી શકાય અને પંખીજગતને વિસ્તૃત રીતે સમજવાની તકો મળે.

મ.કુ.હિંમતસિંહજ  
જ્યુલિય ગ્રાઉન્ડ, સુજ-૩૭૦૦૦૧



## મ.કુ.હિંમતક્રિદ્ધલાલ કલમે



હજી ઘણું જાણવાનું બાકી છે !

ભારતનાં અમુક પક્ષીઓ વિશે હજુ પણ કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. હું થોડા સમય અગાઉ સ્ટોલિક્ઝકાના પિહા (Stoliczca's Bushchat)નો ઉલ્લેખ કરી ગયો છું. એ વિરલ પક્ષી વિશે આપણા સંદર્ભ લખાણોમાંથી એ માહિતી મળે છે કે, તે સ્થાનિક નિવાસી છે. તે અમુક જગ્યાએ શિયાળો ગાળે છે અને ત્યાર બાદ અન્ય જાય છે. ત્યાં તેનું પ્રજનન થાય છે કે કેમ અથવા તે ક્યાં જાય છે, તે બાબત હજી સ્પષ્ટ નથી. તે કેવો માળો બનાવે છે, તેના ઈડાનો રંગ અને તેની સંખ્યા કેટલી હોય છે તે અને બચ્ચાં-ઉછેર વિશે પણ કોઈ જાણકારી હોય તેવું જાણવા મળેલું નથી. કચ્છમાં અભાસા તાલુકાના મથક નલિયા પાસે એ પિહો જોવા મળેલ ત્યારે એ આશા સેવવામાં આવેલી કે, હવે તેના પ્રજનન વિશે અમુક પ્રાથમિક માહિતી મળી રહેશે, પરંતુ એ પક્ષીઓ માર્ય ૨૦૦૨ બાદ અદૃશ્ય થઈ ગયાં અને હજી સુધી જોવામાં આવેલાં નથી.

આપણો ત્યાં Collard Bushchat અથવા Stone Chat આવે છે, જે શિયાળું મુલાકાતી છે અને તે વિદેશમાં તથા ઇમાલયમાં ૭૦૦ થી ૩૦૦૦ મીટરની ઊચાઈએ બચ્ચાં ઉછેરે છે. આ જ મ્રાણો, સ્ટોલિક્ઝકાનો પિહો શિયાળું મુલાકાતી છે? તે આ ઉપભંડની પર્વતમાળામાં પ્રજનન કરે છે, યા આપણા ઉપભંડની સીમા બહાર? આ પ્રશ્નો અનુત્તર રહેછે. રાજસ્થાનના રણ વિસ્તારમાં તે સારી સંખ્યામાં જોવામાં આવે છે, તેથી ત્યાં સતત નિરીક્ષણ કરવામાં આવે તો વધારે માહિતી મળવા સંભવ છે.

હાલ આપણા દેશમાં પક્ષીનિરીક્ષકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. આ ઈસ્મો પક્ષીજગત અને પક્ષીવિજ્ઞાન માટે ઉપયોગી એવું યોગદાન આપી શકે તેમ છે. આ પ્રવૃત્તિ માટે તેમને યોગ્ય માર્ગદર્શન અને ઉત્તેજન આપવાની તાતી જરૂર છે. આવાં નિરીક્ષણ અને સંશોધન કર્યો હાથ ધરવામાં આવે તો ઘડી ખૂટની કરીઓ પૂરી શકાય. મોટા ભાગનાં આવા લોકો, નવાં પક્ષીઓ નોંધી પોતાની યાદીને લાંબી બનાવવા ઉત્સુક હોય છે. આ ઉત્સુકતા અમુક અંશે ઉપયોગી છે અને તેને ઉત્તેજન આપવું જોઈએ. સાથે સાથે, પક્ષીઓની ઓળખ માટે ખાસ ઉપયોગી માર્ગદર્શનની પણ તેવા લોકોને જરૂર

હોય છે, તે

અનુભવી લોકોએ પૂરી કરવી જોઈએ. એક બીજી બાબત પણ પક્ષીઓ જોવા જતાં લોકોએ ખાસ લક્ષ આપવા જેવી છે અને તે એકે, દૂરભીન ઉપરાંત, એક ડાયરી અને પેન્સિલ પણ એ શોખ માટેનાં ઉપયોગી અને જરૂરી સાધનો છે. જે કંઈ કોઈ પક્ષી વિશે જોવામાં આવે જેવાં કે, રંગ, રૂપ, ચાંચનો આકાર તથા તેની આદતો, ઉપરાંત, સ્થળની પસંદગી દા.ત. જાડી, ધાસિયા જમીન ઈત્યાદિ, તે તુરત જ સ્થળ પર ડાયરીમાં નોંધી લેવાં જોઈએ, જેથી એ પક્ષીની વેર આવતાં ઓળખ કરવામાં ચોક્કસાઈ રાખી શકાય. જે કંઈ જોવામાં આવે તે ફક્ત પોતાની યાદશક્તિ પર છોડવું ન જોઈએ. આ બધી પંખીનિરીક્ષણના શોખની ખાસ જરૂરી બાબતો છે. તેના વડે પૂરતી ચોક્કસાઈ રાખી શકાય.

પક્ષીનિરીક્ષકોની એક બીજા પ્રકારની ઉત્સુકતાનો પણ મને અનુભવ થયો છે. એક શાખસને પંખી જોવાનો અને તેમના ફોટા પાડવાનો શોખ છે. તેમણે અમુક ઉચ્ચ કક્ષાના ફોટા લીધા છે. એક વાર તેમણે એક પક્ષીની જોડીને માળામાં બચ્ચાને ખવડાવતાં શોધ્યાં અને પૂરતી ઓળખ કર્યા વિના એમ માની લીધું કે તેમણે એક નવી શોખ કરી. તેમની માન્યતા મુજબ, હજુ સુધી એ પક્ષી આપણા દેશમાં પ્રજનન કરતું નોંધાયું ન હતું. તેના ફોટા પાડ્યા અને 'બોમ્બે નેયરલ હિસ્ટરી સોસાયટી' ને તે ફોટા સહિત એક નોંધ મોકલી આપી. એ નોંધની એક નકલ અને ફોટા મને મોકલ્યા જે જોતાં સ્પષ્ટ જાણાયું કે, એ પક્ષી તો સામાન્ય રીતે આપણું સ્થાનિક નિવાસી છે. મેં તુરત જ શ્રી તેનિયલને જાણ કરી કે એ નોંધ પ્રસિદ્ધ ન કરે. આવી જ રીતે એક બાઈ જે બુજુમાં 'ગાઈડ' સંસ્થામાં કામ કરે છે, તેઓને નવાં પક્ષીઓ શોખવાનો શોખ છે. તેમણે અનેક પક્ષીઓ નોંધાં છે, જેની તેમણે ઓળખ કરવામાં ભૂલી કરી છે. આમ નવાં અને વીરલ પંખીઓની શોખ માટેની ઉત્સુકતા સાથે તેમને યોગ્ય રીતે ઓળખવાની શક્તિના અભાવે કેવા છબરડા વળી શકે તેનાં આ ઉદાહરણો છે! પક્ષીવિજ્ઞાનમાં કોઈ ખોટી માહિતી એક વાર પ્રસિદ્ધ થાય તો તે સુધ્યારવા માટે આજે, ખાસ કરીને કોમ્પ્યુટર યુગમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય.